

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૧૮ ઓગસ્ટ ૨૦૨૩, શુક્રવાર
વિક્રમ સંવત ૨૦૭૯, નિ.શ્રાવણ સુદ બીજ

વર્ષ : ૧૫
અંક : ૨૩

તંત્રી : પટેલ સુરેશ રમણલાલ
અમદાવાદ

કિંમત : રૂ. ૨.૦૦
પાના : ૮

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

છેતરપિંડીને રોકવા માટે સરકાર દ્વારા નવી જાહેરાત

નવી જાહેરાત મુજબ જથ્થાબંધ જોડાણો પર સંપૂર્ણ પ્રતિબંધ, સરકારે ૫૨ લાખ મોબાઈલ કનેક્શન કાપી નાખ્યા, ૬૭,૦૦૦ સિમ ડીલરોને બ્લેકલિસ્ટ કરાયા

સરકારે સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું



। નવી દિલ્હી, તા.૧૭ ।
દેશની કેન્દ્ર સરકાર છેતરપિંડી પર કડક કાર્યવાહી કરવા માટે નવા નિયમો લાવવા જઈ રહી છે. સરકારે સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. હકીકતમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જ આ નવા નિર્ણયની માહિતી આપી છે. આ નવી જાહેરાત મુજબ જથ્થાબંધ જોડાણો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારે સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. વાસ્તવમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જ આ નવા નિર્ણયની માહિતી આપી છે. સમાચાર એજન્સી અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે છેતરપિંડી જેવી ગતિવિધિઓને રોકવા માટે નવી જાહેરાત

કરી છે. આ નવી જાહેરાત મુજબ જથ્થાબંધ જોડાણો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે સરકારે ૫૨ લાખ મોબાઈલ કનેક્શન કાપી નાખ્યા છે. આ સિવાય ૬૭,૦૦૦ સિમ ડીલરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. માહિતી આપતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મે ૨૦૨૩થી અત્યાર સુધીમાં સિમ કાર્ડ ડીલરો વિરુદ્ધ ૩૦૦ FIR નોંધવામાં આવી છે. વોટ્સએપનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે વોટ્સએપે ૬૬,૦૦૦ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. વોટ્સએપે એવા એકાઉન્ટ્સને ઓળખી અને બ્લોક કર્યા છે જે કપટપૂર્ણ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે,

"હવે અમે છેતરપિંડી રોકવા માટે સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. એટલું જ નહીં, જો ધારાધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આવા સિમ ડીલરોને ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે." અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ૧૦ લાખ સિમ ડીલરોને પોલીસ વેરિફિકેશન માટે પૂરતો સમય આપવામાં આવશે. ટેલિકોમ મંત્રાલય હોલસેલ કનેક્શન પર પ્રતિબંધ મૂકવાને બદલે કોમર્શિયલ કનેક્શનનો નવો કોન્સેપ્ટ લાવવા જઈ રહ્યું છે. છેતરપિંડીના મામલા ઘટાડવા માટે સરકારે કેવાયસીપણ ફરજિયાત બનાવ્યું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે બિઝનેસની કેવાયસી, સિમ લેનાર વ્યક્તિની કેવાયસી પણ કરવામાં આવશે.

ન્યૂઝ ડિસ્ક
એસએસસી દ્વારા યોજાતી ભરતી પરીક્ષા ૧૫ ભાષામાં આપી શકાશે

। નવી દિલ્હી, તા.૧૭ ।
કેન્દ્રીયમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓ માટે સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા આયોજિત કરવામાં આવતી ભરતી પરીક્ષા ૧૫ ભાષાઓમાં યોજવાનો નિર્ણય લીધો છે જેથી દેશનો કોઈ પણ યુવાન નોકરીના અવસરથી ચૂકી ન જાય. કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયની ૧૪મી ડિ-ટી સલાહકાર સમિતિની બેઠકને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આ ઐતિહાસિક નિર્ણય સ્થાનિક યુવાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરશે.

મમ્ર માટે ૩૯ અને છત્તીસગઢ માટે ૨૧ ઉમેદવાર જાહેર કર્યા

। નવી દિલ્હી, તા.૧૭ ।
ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વર્ષે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યોમાં યોજાવાની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. ભાજપે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ માટે ૩૯ અને છત્તીસગઢ માટે ૨૧ ઉમેદવારોની જાહેરાત કરી છે. આ વર્ષે જ બંને રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી.

પૂર-ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં ૭૧નાં મોત હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ હજારો કરોડોનું નુકસાન થયું

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વણસી છે : શિમલા અને મંડીમાં ભારે નુકસાન પહોંચ્યું છે : રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યાં છે

। શિમલા, તા.૧૭ ।
હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રવિવારથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. વાદળ ફાટવાના કારણે અહીં ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ છે. રાજ્યના મુખ્ય સચિવ (મહેસૂલ) ઓનજકાર શર્માએ જણાવ્યું કે, ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિમાં અત્યારસુધીમાં ૭૧ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સિવાય કાંગરા જિલ્લામાં પોંગ ઉમમાંથી પાણી છોડવામાં આવતા અનેક વિસ્તારો ડૂબી ગયા છે. જે બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ૧૭૦૦ લોકોને બચાવીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં



આવ્યા હતા. અસરગ્રસ્તોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે જિલ્લા વહીવટી તંત્ર, આર્મી અને ઈન્ડિયન એરફોર્સ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યાં છે. શિમલા તેની જ કટોકટીનો સામનો કરી રહ્યો છે, જેમાં

કેટલીક ઈમારતો ભારે ક્ષતિગ્રસ્ત છે અને ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે છે. શહેરી વિકાસ વિભાગની છ માળની એક બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ હતી. મંગળવારે કુષ્માનગરમાં પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું કતલખાનું ધરાશાયી થયું હતું અને કેટલાંક મકાનો પણ તૂટી પડ્યા હતા. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. કેટલીક ઈમારતોને ભારે ક્ષતિ પહોંચી હોવાથી તે ગમે ત્યારે તૂટી પડી શકે એમ છે. જેના કારણે આસપાસના ૩૫ જેટલાં મકાનોને ખાલી કરાવવામાં આવ્યા અને તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ઓડિશામાં વરસાદી આફત મહિપુરમાં જાતીય હિંસાની તપાસની ક્વાચત ૨૯ મહિલાઓ સહિત ૫૩ CBI અધિકારી તપાસ કરશે

। ભુવનેશ્વર, તા.૧૭ ।
ઓડિશામાં એક જ દિવસમાં વીજળી પડવાથી ૧૨ લોકોના મોત થઈ ગયા છે અને ૧૧ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુતકોમાં ભદ્રક, બાલેશ્વર અને મયૂરભંજના લોકો સામેલ છે. ભદ્રક જિલ્લાના તિહિડી અને ચાંદબાલી બ્લોકથી પાંચ, બાલેશ્વર જિલ્લાના બસ્તા બ્લોકથી પાંચ, મયૂરભંજ જિલ્લાના બેતનટી અને બારીપદા સદર બ્લોકથી એક-એક વ્યક્તિના મોત થયા છે. ઓડિશામાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ૩ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. આ વચ્ચે વીજળી પડવાના કારણે રાજ્યમાં ૧૨ લોકોના મોત થઈ ગયા છે અને ૧૧ ઘાયલ થયા છે. જોકે, આ પહેલી વખત નથી કે, ઓડિશામાં વીજળીનો કહેર જોવા મળ્યો હોય. દર વર્ષે વરસાદ સમયે ઓડિશામાં આવી સ્થિતિ ઊભી થાય છે. ગંભીર વાત એ છે કે, વીજળીનો શિકાર બાળકો પણ બની ગયા છે. કેટલાક બાળકોના પણ મોત થઈ ગયા છે.

। નવી દિલ્હી, તા.૧૭ ।
મહિપુરમાં જાતીય હિંસાની તપાસ માટે ભુધવારે વિભિન્ન રેંકની ૨૯ મહિલા અધિકારીઓ સહિત ૫૩ અધિકારીઓનું વિસ્ટ જારી કરવામાં આવ્યું છે. સીબીઆઈતપાસ હેઠળ આવેલા શરૂઆતના મામલા માટે બે મહિલા ડીઆઈજી રેંકના અધિકારી સહિત ૨૯ મહિલાઓને સામેલ કરવામાં આવી છે. રાજ્યમાં હિંસા અને મહિલાઓ સાથે થયેલા અત્યાચારને લઈને ૬૫ હજારથી વધુ એફઆઈઆરનોંધવામાં આવી છે. તેમાંથી ૧૧ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. તપાસમાં સામેલ ૩ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલના નામ: લવલી કટિયાર, નિર્મલા દેવી અને મોહિત ગુપ્તા આ ત્રણેય અધિકારીઓ રાજ્યોમાં હિંસાના કેસોની તપાસ માટે ટીમોનું નેતૃત્વ કરશે. પોલીસ અધિકારીનું નામ: રાજવીર, સંયુક્ત નિર્દેશકનું નામ: ધનશ્યામ ઉપાધ્યાય. બે મહિલા અધિક પોલીસ અધિકાર

ભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ૨૦ હજાર કરોડના સંરક્ષણ પ્રોજેક્ટને કેન્દ્રની લીલી ઝંડી

સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણને મંજૂરી આપી

। નવી દિલ્હી, તા.૧૭ ।
ભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે ૨૦ હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણને મંજૂરી આપી છે. આ જહાજને તૈયાર થયા બાદ દરિયામાં તેનાત નેવીને બળતણ, શસ્ત્રો અને ખોરાક ભરવામાં મદદ મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર ટોચના સ્તરે મંજૂર

સપોર્ટ જહાજોના નિર્માણ માટે ભારતીય નેવી દ્વારા HSLને નામંકિત કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડને આગામી ૮ વર્ષમાં આ જહાજો બનાવીને નેવીને આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ દરેક જહાજોનું વજન અંદાજે ૪૫ હજાર ટન હશે. HSL દ્વારા પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોનું નિર્માણ કરવામાં આવશે. કેટલાક ભારતીય ખાનગી વતી આ ક્ષેત્રના નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે મળીને કરવામાં આવશે.



કરાયેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયા છે, જેમાં પાંચ અદ્યતન જહાજોનું નિર્માણ થવાનું છે. પાંચ જહાજોનું નિર્માણ વિશાખાપટ્ટનમ ખાતે સંરક્ષણ મંત્રાલયના હિન્દુસ્તાન શિપ યાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ પાંચ ફ્લીટ

મુંબઈની કોર્ટે પતિની અપીલને ફગાવી દીધી આવક ન હોય તો પણ પત્નીને ભરણ પોષણ આપવું પડે : કોર્ટ

। મુંબઈ, તા.૧૭ ।
મુંબઈની એક કોર્ટે પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ નિર્ણયમાં પતિને તેનાથી અલગ રહેતી પત્નીને વયગાળાનું ભરણપોષણ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે તે પતિ પાસે ભલે કોઈ આવક ન હોય છતાં પણ ભરણ પોષણ આપવા સક્ષમ છે. મઝગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું હતું કે પતિની કોઈ આવક નથી એ સાબિત કરતા કોર્ટ પુરાવા નથી. પત્નીએ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં તેનું વિઝિટિંગ કાર્ડ અને કેટલીક અન્ય પોસ્ટ હતી. પત્નીના કહેવા પ્રમાણે આ બાબતો દર્શાવે છે કે તે નોકરી કરી રહ્યો છે. જ્યારે પતિએ જણાવ્યું હતું કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે પણ તેની પાસે ક્યારેય નોકરી ન હતી. વર્ષો સુધી તે નિશ્ચિત આવક માટે ક્યારેય નોકરી કરી નથી. આ તમામ દસ્તાવેજોને ધ્યાનમાં લીધા બાદ મેજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો હતો.

સમાચાર પત્ર છે લોકતંત્રનો ચૌથો સ્તંભ અને પ્રાણ, જે કરે છે એક લોકતંત્રનો નિર્માણ !

શિવસેનાના ચિહ્નને લઈ સુપ્રીમ કોર્ટમાં ૩૧ જુલાઈએ સુનાવણી

CHANNEL NINE NETWORK GUJARAT

◆ ન્યૂઝ પેપર, ◆ ન્યૂઝ ચેનલ, ◆ ન્યૂઝ વેબસાઈટ

આજે જ cnngujarat.co.in વેબસાઈટ ઉપર વિગીટ કરો અને જોડાઈ જાઓ સમાચારની દુનિયા સાથે...

CNN CHANNEL NINE NETWORK GUJARAT Gujarati Daily News Paper LIVE cnngujarat.co.in

ન્યૂઝ ફિક્સ

વડોદરાના ગોત્રીમાં પાન પાર્લર પર SOGના દરોડા

વડોદરા, તા. ૧૭ | રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ છે. છતાં દારુ અને અન્ય નશાકારક પદાર્થો મળી આવે છે. પરંતુ હવે તો થાય છે જ્યારે આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાય છે. વડોદરાના SOGએ ગોત્રીના પાન પાર્લર પર ખાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી નશો કરવામાં વપરાતી આયુર્વેદિક સિરપનો જથ્થો જામ કરવામાં આવ્યો છે. ગોત્રીમાં આવેલું હરિઓમ પાન પાર્લરમાં નશાકારક કફ સિરપ વેચાતી હતી. નશાકારક કફ સિરપ ઉપરાંત પાન પાર્લરમાંથી વિદેશી સિગારેટનો જથ્થો પણ જામ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ અગાઉ રાજકોટ માંથી પણ નશાકારક આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો હતો.

હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકો દીપડાના આતંકથી પરેશાન

હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકો દીપડાના આતંકથી પરેશાન છે, ત્યાં હવે છેલ્લા એક સપ્તાહથી હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફફડાટ વ્યાપ્યો છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ચર્ચાને લઈ વિસ્તારમાં લોકોમાં ભય વ્યાપ્યો છે. ગત સપ્તાહ પોલીસ હેડક્વાર્ટરમાં એક ઘોડાના ચહેરાના ભાગે ઈજા પહોંચવાને લઈ ફફડાટ વધ્યો છે. હિંમતનગર શહેરમાં દીપડાને લઈ છેલ્લા એક સપ્તાહથી ફફડાટ વ્યાપ્યો છે. આ દરમિયાન એક તસ્વીર પણ વાયરલ થઈ હતી અને પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેલ એક ઘોડાને પણ મોઢાના ભાગે ઈજા પહોંચી હતી. શહેરી વિસ્તારમાં આ પ્રકારની ઘટના જોવા મળવાને લઈ દીપડો હોવાની આશંકાએ વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો છે. હિંમતનગર શહેરમાં આવેલ ચાંદનગર, હસનનગર, પરબડા, ભોલેશ્વર, મહેતાપુરા, સરકારી આવાસ યોજના ઉપરાંત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓના બંગલા અને કર્મચારીઓના આવાસ નજીકમાંજ આવેલા છે.



શ્રાવણ મહિનામાં ભગવાન મહાદેવના શિવલીંગ પર બીલીપત્ર ચઢાવવામાં આવે છે. જેના માટે બીલીપત્રના ત્રણ પાનવાળા બીલીપત્ર તૈયાર કરવામાં આવી રહેલ છે.

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા

અમદાવાદ, તા. ૧૭ | કહેવાય છે કે, બધા ભગવાન અને દેવી-દેવતાઓમાં મહાદેવ સૌથી દયાળુ અને ભોળા છે. તેથી તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. શિવ શંભુ તેમની પાસે આવનારા ભક્તોના તમામ દુખડા હરી લે છે. અને દરેકના મનની મનોકામના પુરી કરે છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો. પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટવું હતું. સોમનાથ મહાદેવના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે. સોમનાથ મંદિરે આરાધના કરતા હોય છે. શિવભક્તો શિવમંદિરોમાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. રાજમહેલ રોડ પર આવેલા ઐતિહાસિક અને પૌરાણિક મંદિર કાશી વિશ્વનાથ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ હતી. ભક્તો ૧૫૦૦ વર્ષ જૂના ઐતિહાસિક મંદિર ખાતે શિવજીની આરાધના કરી રહ્યા છે. ભક્તો શિવની ભક્તિમાં લીન બની દેવાધિદેવ મહાદેવને રિઝવવાના પ્રયાસ કરશે. તો શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાન શિવને પ્રિય બિલિપત્ર, દૂધ, ફૂલ સહિતના અલગ-અલગ દ્રવ્યોથી અભિષેક કરશે.

ભરૂચમાં જર્જરિત ઇમારત ધરાશાયી, પરિવાર દબાયો, એકનું મોત નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા

ભરૂચ, તા. ૧૭ | ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ભરૂચ નગરપાલિકા એક સત્તવાર યાદી જાહેર કરી દરવર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસ આપે છે. આ નોટિસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. મકાનમાલિકો પણ તંત્રની કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી વાતને ગંભીરતાથી લેતા નથી જેના આજની ઘટના જેવા માઠા પરિણામ સામે આવે છે.

રાષ્ટ્રવ ગાંધીના જન્મ દિને કોંગ્રેસ યાત્રા યોજશે ગુજરાતની ૨૬ પૈકી ૧૫ લોકસભા બેઠકોમાં કોંગ્રેસને વધારે રસ છે ગુજરાતમાં લોકસભા મિશનને સફળ બનાવવા કોંગ્રેસ પોતાના પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરે તેની સંભાવના છે

અમદાવાદ, તા. ૧૭ | આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પર સૌ કોઈની નજર છે. તેનું કારણ છે કે, લાંબા સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સતત તૂટી રહ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસની ઘણી ગાંઠી સીટો વધી છે. તો લોકસભામાં તો ગુજરાતમાં ઘણાં સમયથી કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શક્યું નથી. ત્યારે આ વખતે કોંગ્રેસે રણનીતિ બદલી છે. જે અંતર્ગત આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાની ૨૬ પૈકી ૧૫ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરશે. છેલ્લી બે ટર્મથી ભાજપ લોકસભામાં ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસને પછાડી રહ્યું છે. આ વખતે પણ ભાજપ સતત ત્રીજાવાર ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો જીતીને જીતની હેટ્ટિક લગાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે કોંગ્રેસ પોતાની રણનીતિ બદલી છે. તમામ ૨૬ બેઠકોમાં સમય બગાડવાને બદલે કોંગ્રેસ કેટલીક બેઠકોની પસંદગી કરી છે. જેની પસંદગી પણ વિવિધ સર્વે અને રિસર્ચ બાદ કરવામાં આવી છે. આ વખતે ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસ કુલ ૨૬ પૈકી ૧૫ બેઠકો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. ઉલ્લેખનીય છે કે, પાછલી બે લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને ગુજરાતમાંથી એક પણ બેઠક પ્રાપ્ત થઈ નથી. તેવામાં હવે કોંગ્રેસ દરેક બેઠક પર મહેનત કરવાને બદલે તેમને જે બેઠકો પોતાને માટે સરળ લાગી રહી છે તેવી બેઠકોની યાદી બનાવીને ત્યાં પ્રયત્ન કરી રહી છે. આ ૧૫ બેઠકોના ચયન માટે ગુજરાત કોંગ્રેસે ૨૦૦૪ અને ૨૦૦૮માં યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામોનો આધાર લીધો છે. કોંગ્રેસ ગુજરાતની ૨૬ લોકસભા પૈકી આ ૧૫ બેઠકો પર વધારે મહેનત કરશે. જેમાં કોંગ્રેસે ઉત્તર ગુજરાતની પાટણ, સૌરાષ્ટ્રની અમરેલી તથા જામનગર, મધ્ય ગુજરાતની ખેડા, આણંદ, પંચમહાલ તથા દાહોદ તેમ જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ તથા બારડોલી બેઠક પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. કારણકે, વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૮માં અહીં કોંગ્રેસની સ્થિતિ સારી હતી.

અમદાવાદમાં ફરી કાર્યાલક બેફામ આનંદનગર રોડ પર ફારે ૨ રિક્ષાને અડફેટે લેતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

અમદાવાદ, તા. ૧૭ | શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. હજી થોડા દિવસ પહેલાં જ તથ્ય પટેલે કરેલા અકસ્માતનો મુદ્દો શાંત નથી થયો ને એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારમાં એક કાર્યાલક ૨ રિક્ષાને અડફેટે લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માત આનંદનગર રોડ પર સર્જાયો હતો. તેના કારણે ૨ લોકોને ઈજા પહોંચી હતી. આ બંને ઈજાગ્રસ્તોને હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર, આનંદનગર રોડ પર આવેલા ટાઈટેનિયમ સિટી સેન્ટર મોલ ખાતે આ અકસ્માત સર્જાયો હતો. અહીં એક કાર્યાલક એક ટેમ્પો, ગાડી અને ૨ રિક્ષાને ટક્કર મારી હતી.

વિશેષ

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિ

ગાંધીનગરમાં મેડટેક એક્સપો-૨૦૨૩ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, ફિક્કી અને મેડટેક ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન આયોજિત ઈન્ડિયા મેડટેક એક્સપો-૨૦૨૩ નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. મેડટેક ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ, હોસ્પિટલ્સ, રિસર્ચર્સ અને ઈન્વેસ્ટર્સ સહિત બધા જ સ્ટેક હોલ્ડર્સને અંડર વન અમ્બ્રેલા લાવનારું આ એક્ઝિબિશન ૧૭ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન યોજાવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશા મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ એક્ઝિબિશનને પુલ્કવું મુકતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા કરેલા સંકલ્પ અન્વયે ભારત ગ્લોબલ મેડટેક હબ થવા સક્ષમ બનશે તેની પ્રતીતિ આ એક્ઝિબિશન કરાવે છે. તેમણે ઉમેર્યું કે, એક સમય હતો કે દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને સંસાધનોનો દાયરો સીમિત હતો અને મોંઘા સાધનો પર નિર્ભર રહેવું પડતું. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હવે દેશની તસવીર બદલાઈ ગઈ છે અને આપણે આત્મનિર્ભર થયા છીએ. એટલું જ નહીં, મેઈક ઈન ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત દેશમાં મેડિકલ ડિવાઈસીસ અને દવાઓના નિર્માણને પ્રાથમિકતા અપાઈ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મોંઘી હેલ્થ સર્વિસીસ, ઈકિવપમેન્ટ્સ અને દવાઓ સામાન્ય જન અને ગરીબ જરૂરત મંદ લોકોને હવે આસાનીથી




મળતા થયા છે. તેમણે આ મેડટેક એક્સપોના આયોજન માટે ગુજરાતની પસંદગીને સારી દિશાની અને સમયાનુકૂળ ગણાવતા ઉમેર્યું કે, ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ છે. ફાર્માસ્યુટિકલ સેક્ટરની ઈન્ડસ્ટ્રીઝ માટે ફેવરિટ ડેસ્ટિનેશન પણ છે. સૌરાષ્ટ્રમાં મેડિકલ ડિવાઈસીસ પાર્ક અને અંકલેશ્વર નજીક બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મેડિસિન અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ગુજરાત લીડિંગ એક્સપોર્ટર સ્ટેટ છે તેની વિગતો પણ આપી હતી. તેમણે ઉમેર્યું કે કાર્ડિયાક હાઈટેક સ્ટેન્ડના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી છે. હાઈટેક ઈન્ટ્રા ઓક્યુલર લેન્સના ઉત્પાદનના પચાસ ટકા ઉત્પાદન ગુજરાત કરે છે તેમજ ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટ ઈન્સ્ટ્રુમેન્ટના ઉત્પાદનમાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે. ભારતના

ભારતે મેડિકલ ડિવાઈસીસ ક્ષેત્રે આગેવાની લેવી જોઈએ અને વાજબી, નવીન અને ગુણવત્તાયુક્ત તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં અગ્રણી બને." કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ આજે જી-૨૦ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકની સાથે સાથે ગાંધીનગરમાં ભારતના પ્રથમ મેડિકલ ટેકનોલોજી એક્સપો, ઈન્ડિયા મેડટેક એક્સપો ૨૦૨૩માં પોતાનાં ઉદઘાટન સંબોધન દરમિયાન આ વાત કરી હતી. તેમની સાથે નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલ અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી રૂપિકેશ પટેલ પણ જોડાયા હતા. ડૉ.માંડવીયાએ જણાવ્યું હતું કે, "મેડટેક એક્સપો ૨૦૨૩ માટે માનનીય પ્રધાનમંત્રીના ભારતને 'આત્મનિર્ભર' બનાવવાના વિઝનમાંથી પ્રેરણા મળી છે. તે ભારતીય ચિકિત્સા ઉપકરણની ઈકોસિસ્ટમની ક્ષમતા અને ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે એક વિશિષ્ટ, સર્વસમાવેશક પ્લેટફોર્મ હશે." તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, હુંએનડિયા એ ઉભરતા બજારોમાં સૌથી ઝડપથી વિકસતું તબીબી ઉપકરણનું બજાર છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, "અમારું લક્ષ્ય તબીબી ઉપકરણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનું છે. અને આપણી આયાત પરની નિર્ભરતાને ઘટાડે છે, જે સંપૂર્ણપણે તેની સાથે સુસંગત છે અમારું 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'નું અમારું વિઝન છે. ઓટોમેટિક ડ્રટ હેઠળ તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે ૧૦૦ ટકા સુધી એક્ઝિટીવેશન મંજૂરી આપવામાં આવી છે." તેમણે જણાવ્યું હતું કે "ભારતમાં તબીબી ઉપકરણોના



ન્યૂઝ બ્રિફ

ન્યૂયોર્ક સિટીમાં પણ ટિકટોક પર પ્રતિબંધ લાદી દેવાયો



ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લાગવાથી આ યાઈનીઝ એપ કંપનીને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ હવે તેને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતમાં પ્રતિબંધ બાદ હવે ન્યૂયોર્ક સિટીએ પણ આ એપને પ્રતિબંધિત કરી દીધી છે. તેની પાછળનું કારણ સુરક્ષા હોવાનું કહેવાય છે. ન્યૂયોર્ક સિટી મેયર એરિક એડમ્સના પ્રવક્તા જોના એલને જણાવ્યું હતું કે શહેરના સાયબર કમાન્ડે જાણ કરી છે કે એપ શહેરના ટેકનિકલ નેટવર્ક માટે સુરક્ષા માટે ખતરો છે. તમામ એજન્સીઓને ૩૦ દિવસની અંદર તેને રિમૂવ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત કમ્યુનિટીઓ તેનો ઉપયોગ સરકારી ઉપકરણો અને નેટવર્ક પર કરી શકશે નહીં. જ by યુએસએમાં ટિકટોકની વ્યુઝરબેઝ ૧૫૦ મિલિયનથી વધુ છે અને એપ ચીનની ટેક કંપની બાયટડાન્સની માલિકીની છે. સુરક્ષાના કારણોસર આ એપને ઘણી જગ્યાએ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. જો કે ટિકટોકે કહ્યું છે કે તે અમેરિકન યુઝર્સનો ડેટા ચીન સરકાર સાથે શેર કરતું નથી. એપ્રિલની શરૂઆતમાં મોન્ટાના લોમેકરે પણ એક બિલ પ સાર કર્યો અને લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોકના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે ટિકટોકે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. આટલું જ નહીં, એકબીઆઈડાયરેક્ટર સહિત અમેરિકન સુરક્ષા અધિકારી ક્રિસ્ટોફર રેએ પણ કહ્યું કે ટિકટોક ખતરો પેદા કરી શકે છે. ભારતમાં વર્ષ ૨૦૨૦માં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેની પાછળ સુરક્ષાને કારણે બતાવવામાં આવ્યો હતો. જૂન ૨૦૨૦માં ભારત સરકારે ટિકટોક અને હેલો સહિત ૫૯ યાઈનીઝ એપ્સને બંધ કરી દીધી હતી. જો કે કંપનીએ થોડા સમય માટે પ્રતિબંધ ખુલવાની રાહ જોઈ, તે પછી કંપનીએ ભારત છોડવાનો નિર્ણય કર્યો હતો.

બે કલાક સુધી બંને વચ્ચે શું થઈ ચર્ચા? (BCCI)ના સેક્રેટરી અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ વચ્ચે સામાન્ય વાતચીત જેવું લાગે છે જય શાહ-રાહુલ દ્રવિડ વચ્ચે થઈ અમેરિકામાં સીક્રેટ બેઠક એવું માનવામાં આવી રહ્યું છે કે, એશિયા કપ અને વર્લ્ડ કપ અંગેની ચર્ચા આ બેઠકમાં થઈ હોવી જોઈએ

બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદ ખેલાડીઓમાં જુસ્સાના અભાવને ટાંકીને દ્રવિડના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ટીમની જાહેરાત ક્યારે કરવામાં આવશે તેની પણ પસંદગી સમિતિને જાણ નથી. સૂત્રોનું માનીએ તો ટીમ સિલેક્શન આયર્લેન્ડમાં પ્રથમ T૨૦ ઈન્ટરનેશનલ પછી થઈ શકે છે, કારણ કે જસપ્રીત બુમરાહ કેટલો ફિટ છે તે એક મેચ પછી જ ખબર પડશે. કેએલ રાહુલ અને શ્રેયસ અચ્ચર હજુ પણ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. ભૂતકાળમાં બંને ત્યાં પ્રેક્ટિસ મેચનો ભાગ પણ હતા. બંનેની ફિટનેસ અંગે અપડેટની હજુ રાહ જોવાઈ રહી છે. આશા છે કે એશિયા કપ પહેલા બંને ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ જોવા મળશે.

જય શાહે તાજેતરમાં મિયામીમાં રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. મળતી જાણકારી મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ વચ્ચે સામાન્ય વાતચીત જેવું લાગે છે. પણ વાત એટલી સરળ નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T૨૦ ઈન્ટરનેશનલની શરૂઆત પહેલા ફ્લોરિડાના લોડરહિલમાં ૧૨ અને ૧૩ ઓગસ્ટના રોજ બેઠક થઈ હતી. અમારા સહયોગી ક્રિકેટમાં છપાયેલા અહેવાલ મુજબ આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. ભારતીય ટીમ મિયામીની મેરિયોટ હોટલમાં રોકાઈ હતી, પરંતુ અંગત મુલાકાતે અમેરિકા પહોંચેલા જય શાહ અન્ય હોટલમાં રોકાયા હતા, તે માત્ર રાહુલ દ્રવિડ જ તેમને મળવા ગયા હતા. આ બેઠક ત્યારે થઈ જ્યારે ભારતીય ટીમ આગામી બે મહિનામાં એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ રમવાની છે. જ્યારે બંધ દરવાજા પાછળ બેઠકમાં શું થયું તેનું ફક્ત અનુમાન કરી શકાય છે, તે સ્પષ્ટ છે કે આ બેઠક દરમિયાન બંને મોટી ઘટનાઓની યોજનાઓ બનાવવામાં આવી



મળવા ગયા હતા. આ બેઠક ત્યારે થઈ જ્યારે ભારતીય ટીમ આગામી બે મહિનામાં એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ રમવાની છે. જ્યારે બંધ દરવાજા પાછળ બેઠકમાં શું થયું તેનું ફક્ત અનુમાન કરી શકાય છે, તે સ્પષ્ટ છે કે આ બેઠક દરમિયાન બંને મોટી ઘટનાઓની યોજનાઓ બનાવવામાં આવી

વિવિધ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાન સાથે બંધ થયા સેન્સેક્સ ૩૮૮ પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી ૧૯૪૦૦ પોઈન્ટની નીચે બંધ પીએસયુ બેન્ક સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો આજે ઘટાડા સાથે બંધ : અદાણી પોર્ટ્સના સ્ટોકમાં વધારો

સ્થાનિક શેરબજાર આજે ભારે ઘટાડા સાથે બંધ થયું. બીએસઈસેન્સેક્સ ૩૮૮.૪૦ પોઈન્ટ એટલે કે ૦.૫૯ ટકાના ઘટાડા સાથે ૬૫,૧૫૧.૦૨ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી ૯૯.૦૫ પોઈન્ટ એટલે કે ૦.૫૧ ટકાના ઘટાડા સાથે ૧૯,૩૬૫.૨૫ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પર આઈટીસીનો શેર મહત્તમ બે ટકાના નુકસાન સાથે બંધ થયો હતો. અદાણી પોર્ટ્સનો સ્ટોક ૪.૪૩ ટકાના વધારા સાથે બંધ થયો હતો. બીએસઈસેન્સેક્સ પર આઈટીસીનો શેર (આઈટીસી) સૌથી વધુ ૨.૦૪ ટકાના નુકસાન સાથે બંધ થયો હતો. તેવી જ રીતે પાવરગ્રીડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ સ્ટીલ, ટાટા મોટર્સ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક,



એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, ઈન્ડસર્વિસ બેંક, ટીસીએસ અને એચયુએલ બંધ છે. લાલ નિશાન. ટાઈટનનો શેર સેન્સેક્સમાં સૌથી વધુ ૨.૧૨ ટકાના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે એસબીઆઈ, બજાજ ફિનાન્સ, એક્સિસ બેંક, ટાટા સ્ટીલ અને સન ફાર્માના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. પીએસયુ બેન્ક સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાન સાથે બંધ થયા છે. કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, એફએમસીજી અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર સંબંધિત ઈન્ડેક્સ ૦.૩-૦.૯ ટકા સુધી ઘટીને બંધ થયા છે.

ડોક્ટરોએ ફરીથી સર્જરી કરીને સીઝરને કાઢી હતી સિમેરિયન ડિલિવરી બાદ મહિલાના પેટમાં કાતર ભૂલી ગયા ડોક્ટરો મહિલા ડિસ્ચાર્જ થયા બાદ ઘરે ગઈ હતી અને તેને તીવ્ર દુઃખાવો ઉપડ્યો હતો : સોનોગ્રાફી બાદ આ વાત સામે આવી

ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે. કહેવાય છે કે, જો ભગવાન બાદ વ્યક્તિની રક્ષા કરે છે તો તે ડોક્ટર જ છે. પરંતુ જ્યારે ડોક્ટર જ બેદરકારી દાખવે તો વ્યક્તિનો જીવ જવામાં સમય લાગતો નથી. જવાબદારીની સમયે બેદરકારીનો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આંધ્રપ્રદેશના વિજયવાડાના એલુરુ સરકારી હોસ્પિટલની જ વાત કરીએ તો, અહીંયાના ડોક્ટરો સિમેરિયન ક્યા બાદ મહિલાના પેટમાં જ સર્જિકલ સીઝર ભૂલી ગયા હતા. સર્જિકલ પ્રક્રિયા બાદથી જ મહિલાએ પેટમાં તીવ્ર દુઃખાવાની ફરિયાદ કરતાં અન્ય હોસ્પિટલમાં તેની અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટરોની બેદરકારી પ્રકાશમાં આવી હતી. એલર જિલ્લાના કલેક્ટરે બેદરકારીની ગંભીર નોંધ લીધી હતી અને જિલ્લા મેડિકલ અને હેલ્થ ઓફિસર પાસેથી રિપોર્ટ માગ્યો હતો. પેટાપુ મંડળના એસ કોથાપલ્લી ગામની સગબા મહિલા જી સ્વપ્નાને ૧૯ એપ્રિલે ડિલિવરી માટે એલુરુની

સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું સિમેરિયન કરવામાં આવ્યું હતું અને તેણે બાળકને જન્મ આપ્યો હતો. ડિસ્ચાર્જ મળ્યા બાદ સ્વપ્ના ઘરે જઈ હતી. જો કે, તેને વારંવાર પેટમાં દુખાવો થતો હતો. સામાન્ય પેટમાં દુખાવો થતો હતો. સામાન્ય દુઃખાવો થતો હોવાનું સમજીને તે દવા લેતી રહી હતી. ૮મી ઓગસ્ટે સ્વપ્નાને પેટમાં તીવ્ર દુઃખાવો ઉપડ્યો હતો અને તે એલુરુની હોસ્પિટલે પાછી ગઈ હતી. ત્યાંના ડોક્ટરોએ તેનું ચેકઅપ કર્યું હતું અને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી, જ્યાં એક્સ-રેમાં તેના પેટમાં સર્જિકલ સીઝર રહી ગઈ હોવાનો ખુલાસો કર્યો હતો. વિજયવાડા સરકારી હોસ્પિટલના ડો. પ્રભાકરે સર્જરી કરી હતી અને સીઝરને દૂર કરી હતી. ૧૦મી ઓગસ્ટે સ્વપ્નાને ઈલુગુથી ત્યાં લઈ જવામાં આવી હતી. 'સર્જિકલ સીઝર પેટમાં રહી ગઈ હતી અને તેની સાઈઝ બે ઈંચ જેટલી હતી. પેટમાં રહી ગયેલી કાતર તેના આંતરડામાં ચોંટી ગઈ હતી અને તેના કારણે તેને ચેપ લાગ્યો હતો. અમે ચેપપ્રસ્ટ આંતરડાનો ભાગ દૂર કર્યો હતો. તેની સારવાર ચાલી રહી છે', તેમ તેમણે ઉમેર્યું હતું. આ સાથે દર્દીની તબિયત હવે સ્થિર હોવાનું કહ્યું હતું. હેડ ઓફ સર્જરી ડો. અપ્પા રાવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જો મહિલાએ તેની પીડાની અવગણના કરી હોય તો ચેપના કારણે કદાચ તેનો જીવ પણ જતો રહ્યો હોત. એલુરુના જિલ્લાના કલેક્ટર વી પ્રસન્ના વેંકટેશ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. થોડા દિવસ પહેલા કેરળની કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં મહિલાનું ઓપરેશન કર્યા બાદ ડોક્ટરો પેટમાં સીઝર ભૂલી ગયા હતા. ઓપરેશન છેક ૨૦૧૯માં થયું હતું. મહિલાની સામે હકીકત આવતા તેણે હોસ્પિટલના બે ડોક્ટરો અને બે નર્સિંગ સ્ટાફ સામે બેદરકારીનો આરોપ લગાવ્યો હતો, તે છેક સુધી લડત લડી હતી. ૩૦ નવેમ્બર ૨૦૧૯માં તે પોતાની ત્રીજી ડિલિવરી માટે મેડિકલ કોલેજ હોસ્પિટલ ગઈ ત્યારે આ ગરબડ થઈ હતી.



કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પુરી જિલ્લામાં કલાકાર સુદર્શન પટ્ટનાયક દ્વારા બનાવવામાં આવેલ 'મેરી માટી મેરા દેશ' થીમ પર સેન્સ આર્ટ સાથે ફોટો માટે પોઝ આપે છે.

પ્રયાગરાજથી ચોંકાવનારી તસવીરો સામે આવી સરકારી શાળામાં તિરંગા પર નાસ્તો કરી ફોટા લીધા મામલો સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ નોમિનેશન રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો

પ્રયાગરાજ, તા.૧૭ | ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે. સોશયલ મીડિયા પર વાયરલ થયેલી ફોટોસમાં ટેબલ પર તિરંગા જેવું કપડું પથરાયેલું છે. કાપડ પર ઘણો નાસ્તો રાખવામાં આવ્યો છે. ઘણા લોકો ટેબલની આસપાસ બેઠા છે અને ફોટો ક્લિક કરી રહ્યા છે. આ વાયરલ થઈ રહેલી ફોટો પ્રયાગરાજની એક સરકારી શાળાની છે અને આ ફોટો સ્વતંત્રતા દિવસ એટલે કે ૧૫મી ઓગસ્ટના દિવસની છે. મામલો

સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ નોમિનેશન રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રયાગરાજના હોલાગઢમાં સરકારી શાળામાં ૧૫ ઓગસ્ટના રોજ કાર્યક્રમ બાદ શાળામાં ઉપસ્થિત લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નાસ્તા માટે ટેબલ ગોઠવ્યું હતું. ટેબલ પર કાપડ મૂક્યા પછી, તેના પર નાસ્તાની ઘણી પ્લેટો સજાવવામાં આવી હતી, પરંતુ ટેબલ પર પથરાયેલું આ

કાપડ તિરંગા રંગનું હતું. સ્કૂલમાં હાજર લોકોની તસવીરો સોશયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. તિરંગાના કપડા પર રાખેલો નાસ્તો જોઈને લોકો ભડકી ઉઠ્યા હતા. આ પછી હોલાગઢના દહિયાવા વેપારી મંડળે આ મામલે પોલીસને જાણ કરી હતી. આ સાથે ચાર લોકો સામે નોમિનેશન રિપોર્ટ પણ દાખલ કરવામાં આવ્યો હતો. દહિયાવા વેપારી મંડળના લોકોએ દેશનો તિરંગાનો અપમાન હોવાના આક્ષેપ સાથે લેખિત ફરિયાદ કરી છે.

સોશયલ મીડિયા પર રાજસ્થાનનો વીડિયો વાયરલ હનુમાનગઢમાં ફાર ચાલકે મહિલાને બોનેટ પર ટસડી

હનુમાનગઢ, તા.૧૭ | હાલ સોશયલ મીડિયા પર રાજસ્થાનનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ફાર ચાલક એક મહિલાને તેની કારના બોનેટ પર લગભગ ૫૦૦ મીટર સુધી ટસડી હતી.

તેનું વાહન રોક્યું ન હતું. પોલીસે જણાવ્યું કે કથિત ઘટના ગઈકાલે બપોરે હનુમાનગઢના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે બની હતી. પોલીસે કહ્યું કે ઘણા સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા બાદ કારનો નંબર સ્પષ્ટ થઈ ગયો, જે રાવલાના એક વ્યક્તિના નામે રજિસ્ટર છે. આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડની આસપાસ લાગેલા સીસીટીવી જોવા મળ્યા હતા, પરંતુ ડ્રાઈવરે

કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનો વીડિયો ખુબ જ વાયરલ હિંદુ ધર્મ ઈસ્લામ ફરતા જૂનો છે ગુલામનબી આઝાદનો દાવો ઈસ્લામનો જન્મ ૧૫૦૦ વર્ષ પહેલા થયો હતો : ભારતમાં કોઈ બહારનું નથી, ભારતના મુસ્લિમો મૂળ હિંદુ હતા : આઝાદ

નબી દિલ્હી, તા.૧૭ | કોંગ્રેસથી અલગ થઈને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવનાર અને જન્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ લોકોને કહી રહ્યા છે કે હિંદુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો છે અને પહેલા બધા મુસ્લિમો હિંદુ હતા. આ પહેલા જેએનયુવિદ્યાર્થી સંઘની નેતા શેહલા રાશિદનું એક નિવેદન

સામે આવ્યું હતું, જેમાં તેણે જન્મુ-કાશ્મીરમાં વિકાસ માટે સરકારના વખાણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ગુલામ નબી આઝાદનો વીડિયો જન્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાનો છે. આ વીડિયોમાં આઝાદ કહે છે ઈસ્લામનો જન્મ ૧૫૦૦ વર્ષ પહેલા થયો હતો. ભારતમાં કોઈ બહારનું નથી. આપણે બધા આ દેશના છીએ. ભારતના મુસ્લિમો મૂળ હિંદુ હતા, જેમણે પાછળથી ધર્માતરણ કર્યું હતું. આઝાદ ડોડામાં આપેલા ભાષણમાં કહે છે કે ૬૦૦ વર્ષ પહેલા કાશ્મીરમાં માત્ર કાશ્મીરી પંડિતો હતા. પછી ઘણા લોકો ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા હતા. આ દરમિયાન આઝાદે લોકોને ભાઈચારો, શાંતિ અને એકતા જાળવવા વિનંતી કરી અને કહ્યું, 'ધર્મને રાજનીતિ સાથે ન જોડવી ન જોઈએ. લોકોએ ધર્મના નામે મત ન આપવા જોઈએ. આ સાથે જ ગુલામ નબી આઝાદે ધર્મને રાજકારણ સાથે જોડનારાઓને પણ નિશાન સાધતા કહ્યું કે રાજનીતિમાં ધર્મનો સહારો લેનાર કમજોર છે.

તંત્રી લેખ...



સોશિયલ મીડીયાના વાઈરલ વાયરસ સામે હવે સખગતા જરૂરી

સોશિયલ મીડીયાના વાઈરલ વાયરસ સામે હવે સખગતા જરૂરી. સરકારની સાથેસાથે ન્યાયતંત્ર પણ સોશિયલ મીડીયા પ્લેટફોર્મના ભય સ્થાનો અંગે સખગતા બનીને સોશિયલ મીડીયાના ગેરઉપયોગ સામે યોગ્ય વ્યવસ્થાના હિમાયતી બન્યાં છે. સોશિયલ મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ બાળકોની રમત નથી તેની ગંભીરતા અને પ્લેટફોર્મના સંચાલકોની જવાબદારી ફિક્કસ થવી જોઈએ. સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય. અત્યારે પ્રસાર માધ્યમનો ટેકનોલોજીના માધ્યમથી ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. પરંતુ હાલમાં જોવા મળ્યું છે કે, હરીયાણાના નૂડમાં કેવી રીતે હિંસા ફાટી નિકળી હતી જેના લીધે સમગ્ર ભારતીયને નિયુ જોવું પડ્યું હતું કારણ કે, ત્યાં હિન્દુ મુસ્લીમ વચ્ચે ફાટી નિકળેલા દંગાએ ઘણો જ ઉગ્ર સ્વરૂપ લીધો હતો, અને આનુ કારણ ખરેખર માત્રને માત્ર સોશિયલ મીડીયા જ છે કારણ કે, લાઈવ કેમેરા અને ધનાધન ગમે તેવી રીતે બેફામ બેફાટ બોલીને પછી લોકોને ઉદ્દેશીના કારણે જ આ બનાવો બનતા હોય છે. ખેર, આંગળીના ટેરવે સમગ્ર વિશ્વને હાથવગુ બનાવનાર ડીઝીટલ મીડીયા પર આચાર સંહિતા અને નિયંત્રણ હોવું જોઈએ. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયાથી લઈને જાપાન જેવા ટેકનોલોજી ક્ષેત્ર અને બિઝનેસ ટાઈકૂન ચીન પણ વાઈરલ વાઈરસ સામે સૌથી વધુ સખગતા છે. અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ ગત પ્રમુખ પદની યુટીડીમાં વાઈરલ વાઈરસનો કડવો અનુભવ થઈ ચુક્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં ડીઝીટલ પ્લેટફોર્મ સરકાર અને કાયદાના સંપૂર્ણ નિયંત્રણમાં હોય તે જરૂરી છે. દિલ્હી હાઈકોર્ટ પોતાના અલ્ટીમાટમમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે સોશિયલ મીડીયાનો ઉપયોગ બાળકની રમતની જેમ ન થવો જોઈએ. વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા કંટેન્ટથી લઈને મેસેજ ફોરવર્ડ કરવા સુધીની સામાન્ય ગણતી બાબતો પણ કાયદાથી નિયંત્રિત હોવી જોઈએ. ડીઝીટલ પ્લેટફોર્મની સવલતનો ઉપયોગ આવકાર્ય છે પરંતુ દૂર ઉપયોગ કોઈ સંજોગોમાં ન ચલાવી લેવાય. પરંતુ લોકો પોતાના એકાઉન્ટ ઉપરથી ગમે તેમ બેફાટ બકવાસ કરી લે છે અને આવમાં સરકારશ્રી તરફથી પણ કોઈજ એક્શન લેવામાં આવતા નથી, અને જ્યારે એક્શન મોડમાં પોલીસ તંત્ર આવે છે ત્યાં સુધી તો બધું બળીને ખાખ બની જતું હોય છે. કાશ કે મોબાઈલની જોમ માણસમાં પણ પાઉસ અને પ્લે નું બનત હોત...

ફિઝિકલ એક્ટિવિટીને લઈ આભસ

હાલમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અને વ્યાપક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશની અડધીથી વધારે વસ્તીનો શારિરિક પ્રવૃત્તિ અથવા તો ફિઝિકલ એક્ટિવિટીમાં કોઈ રસ નથી. દેશના અડધા લોકો શારિરિક ગતિવિધીથી દુર રહેવાનું પસંદ કરે છે. એટલે કે આભસ રાખે છે. ૧૦ ટકાથી પણ ઓછા લોકો એવા છે જે મનોરંજન તરીકે શારિરિક ગતિવિધીમાં સામેલ રહે છે. આસીએમઆરના ડેટામાં આ બાબતનો ખુલાસો થયો છે. જો કે કેટલાક લોકો આ ખુલાસા સાથે સહમત નથી. તેમની દલીલ છે કે આધુનિક ભારતમાં લોકો શારિરિક ક્રિટનેસને લઈને વધારે સાવધાન થઈ રહ્યા છે. દિલ્હી સ્થિત પ્રાઈમસ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગના તબીબો કહે છે કે આધુનિક સમયમાં આર્થરોઈટિસ જેવી જોડાની તકલીફ હવે વય સુધી મર્યાદિત રહી નથી. શારિરિક રીતે કામ ન કરવાની બાબત પણ આ બિમારીના બોજને વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે. ડબલ્યુએચઓના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે દુનિયાભરમાં પાંચમાંથી એક પુષ્કવચના લોકો અને પાંચમાંથી ચાર કિશોર વચના લોકો શારિરિક ગતિવિધી કરતા નથી. જેના કારણે હેલ્થ કેરપર પૈ અબજ ડોલરની સીધી અસર થઈ રહી છે. તબીબો કહે છે કે આઈસીએમઆરના આંકડા દર્શાવે છે કે ૫૪.૪ ટકા લોકો શારિરિક ગતિવિધી કરવામાં રસ ધરાવતા નથી. આ સરકારી એજન્સી દ્વારા કરવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકો યાત્રા અને મનોરંજન સાથે જોડાયેલી શારિરિક ગતિવિધીની તુલનામાં કામમાં વધારે સમય પસાર કરે છે. આગસી જીવનશૈલી, કસરત ન કરવાની બાબત અથવા તો કોઈ પ્રોફેશનલની દેખરેખ વગર કસરત કરવાથી યુવાના જોડામાં લિગામેન્ટમાં તકલીફ પડે છે. જેમ જેમ અમારી વય વધે છે અમારા શરીરમાં કામ કરવાની ક્ષમતા ઘટતી જાય છે. અમારા શરીરમાં હાડકા ફરી બનવા અને રિપેયર થવાની ક્ષમતા ઓછી થવા લાગી જાય છે. અમારા શુટ્લમાં મુલાયમ ટિશ્યુ હોય છે જેને કાર્ટિલેજ કહેવામાં આવે છે. જે માંસપેશિયાઓને ટેકો આપે છે. જેના કારણે શારિરિક ગતિવિધી કરતી વેળા સરળતા મળે છે. આ એક પ્રકારથી શોક ઓબ્જર્વર તરીકે કામ કરે છે. સમયની સાથે આ મુલાયમ ટિશ્યુ ઘસી જાય છે. જેના કારણે જોડામાં જગ્યાઓ બનતી જાય છે. કાર્ટિલેજના ડિજરનેશનના કારણે આર્થરોઈટિસ થવા લાગી જાય છે. તે જોડામાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધી કસરત લાઈફમાં ત્રણ વર્ષનો ઉમેરો કરે છે. તાઈબાનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત જાણવા મળી છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો ૩૦ મિનિટ સુધીની કસરત કરે તો તેમના લાઈફમાં ઉમેરો કરી શકે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સપ્તાહમાં પાંચ દિવસ કસરત કરવાથી પણ ફાયદો મળે છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે ઓછા ડોઝના કારણે ઓછો ફાયદો થાય છે પરંતુ નિયમિત રીતે ૩૦ મિનિટ સુધી કસરત ખૂબ જ આદર્શ છે. લીડ રિયસંર તાઈવાનના સીપેંગે કહ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધીની કસરતથી પણ ફાયદો થાય છે. વોકીંગથી પણ ફાયદો થાય છે. તાઈવાનની નેશનલ હેલ્થ રિયર્ચ ઈન્સ્ટીટ્યુટના પેંગે કહ્યું છે કે પુરુષો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધ લોકો તેમજ ધૂમ્રપાન કરનાર લોકો તથા અસ્વસ્થ રહેતા લોકો માટે પણ નિયમિત પણે કસરત ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ દર્દીઓ કોઈ ખાસ તકલીફના દર્દીને જુએ છે ત્યારે વોકીંગની સલાહ આપે છે અથવા તો તેને હળવી કસરતની સલાહ આપે છે. મેડીકલ જનરલમાં પ્રકાશિત થયેલા તેમના નારણવા મળ્યું છે કે સપ્તાહમાં આવ્યું છે કે ૪૧૬૦૦૦ લોકોને આવરી લઈને આ સર્વ કરવામાં આવ્યો હતો જેમાં મોટાભાગના લોકોના મત જાણવામાં આવ્યા હતા. તેમના આરોગ્ય અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૫ મિનિટ કસરતથી ઉપયોગી ફાયદો થાય છે.

દ્રાપર યુગના મહાભારત કાળનો ઇતિહાસ ધરાવતું અને પાંડવોથી સ્થાપિત આખલોલ મહાદેવનું અનોખું મંદિર



સદગુરુ વયનામૂર્તિ
સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)



શ્રાવણ આવ્યો અને હર હર શંભુ, તથા ઓમ નમઃ શિવાયનાના નાદથી શિવાલયો ગુંજશે. શ્રાવણે શિવાલયનો મહિમા જ કંઈક અલગ હોય છે અને દર્શનને જનારાના જન્મારા સુધરી જતાં હોય છે. લોકોના એ અલખનાદને માણવા માટે શિવાલયમાં જવું પડે, પરંતુ અમુક તીર્થ મંદિરમાં બધા રોજ જઈ શકે નહીં. એ તો છોડો સમયનો એવો કાળ ચાલે છે કે ઘરમાં ને ઘરમાં રહેલા મંદિરમાં જવું પણ ઘણી વખત શક્ય બનતું નથી. ઉપરથી કાળ માથે મૃત્યુની તલવાર લઈ ને ઉભો છે, તો આપણે રોજ અલગ-અલગ શિવાલય વિષે વાત કરીશું. શ્રાવણ એટલે ભક્તિભાવનો મહિનો અને એમાં પણ શંકર જેવો આરાધ્ય દેવ કે જે, માત્ર પાણીથી પણ પ્રસન્ન થાય, અને બીલીપત્ર ચઢાવવાથી સાધકના ત્રણેય કાળના દુઃખ દર્દ દૂર કરે, અને સ્મરણ માત્રથી તેની આસપાસ મંડરાતી મેલી મુરાદ ચાલી જાય, એને આ રીતે ભજીશું. શંકર પોતે સંસારી હોવાથી સંસારીના દુઃખદર્દ વધુ ઝડપથી સમજી શકે, અને ભોળો ભંડારી કાયમ ભક્ત વત્સલ બની આપણી સમસ્યામાં વીધ પી જાય, આજે આપણે ભાવનગર વરતેજને જોડતા એક અનોખાં શિવાલય એટલે કે આંખલોલ મહાદેવની આપણે વાત કરીશું. જે આજે પણ દર્શનને આવનાર ને સત્ય સાત્વિક શ્રદ્ધાથી ભરનાર છે.

ભાવનગર શહેર અને વરતેજનાં સીમાડે આવેલું આ આખલોલ મહાદેવ એટલે કે ગંગાનાથ મહાદેવ અને પંચનાથ મહાદેવ નામથી પણ તે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે આ મંદિર પાંડવોનાં સમયનું છે, અને સ્વયં પાંડવોએ અહીં તેની સ્થાપના કરી છે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ પૂર્ણ થતા યુધિષ્ઠિર અને બાકીના પાંડવો ભગવાન શ્રીકૃષ્ણ પાસે જાય છે, અને કહે છે કે એ દારિકાનાથ આ યુદ્ધમાં મહા સંહાર થયો છે, અને એમાં કેટલીય હત્યાઓનાં અમે નિમિત્ત બન્યા છીએ. માટે તેનો ભાર લાગે છે, જો અમારા આ પાપને ધોઈ શકાય તો સારું. ભગવાન તેને જણાવે છે કે, સૌરાષ્ટ્ર પંથકમાં ભાવેણા નામની નગરી છે, અને ત્યાં આગળ નિષ્કલંક નામે મહાદેવ આવેલું છે, એ મંદિરમાં તમે જઈ અને ત્યાં આગળ સડધોપ

ભાદરવી અમાસ અને ઋષિ પાંચમ નો મેળો ભરાય છે આ ઉપરાંત શિવરાત્રીના તહેવારને પણ ધૂમધામથી મનાવવામાં આવે છે મહિનો શ્રાવણ હોય કે બીજો, આપણે તો બસ ઐ નમઃ શિવાય નો સીધોસાદો મંત્ર સ્મરી એને ભજી લેવાનો છે. અન્ય દેવી દેવતા ઓનાં લાંબા લાંબા કર્મકાંડીય યજ્ઞ કે પૂજન વિધિ જેવું કંઈ જ કરવાનું નથી. ભગવાન શંકર તો ભક્તનાં ભાવથી રીજી જનારો છે તેને અન્ય કોઈ સાધનની જરૂર નથી પરંતુ આપણી પાસે તેને દેવા માટે શુદ્ધ ભાવ પણ ક્યાં છે તો ભાવનગરના આ શિવાલયના દર્શન કરી અને શુદ્ધ થઈ શુદ્ધ ભાવે આખલોલ મહાદેવ ને સ્મરીએ.તો આ વાત છે ભાવેણાના સૌથી પ્રાચીન મંદિર એટલે કે આશરે સાડા પાંચ હજાર વર્ષ પહેલા સ્વયમ પાંડવો એ જેની સ્થાપના કરી હતી એવા સ્વયંભૂ શિવલિંગની વાત અને ધર્મરાજ યુધિષ્ઠિર ના હાથે જેનો ધડશોપચાર વિધિથી પૂજન થયું હતું, એવા આ શિવલિંગ ના દર્શન માત્રથી આપણા ત્રણે કાળના પાપનો નાશ થાય છે. તેમજ એક અદ્ભુત ઉર્જાનો અનુભવ થાય છે. તો આ શ્રવણે આપણે આ રીતે આ શિવાલયનો ઇતિહાસ જાણીશું, અને સમય અનુકૂળ થતાં સૌ કોઈ તેના દર્શનનો લાભ લઈ મુદ પવિત્ર થઈશું, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. મહિનો શ્રાવણ હોય કે બીજો, આપણે તો બસ ઐ નમઃ શિવાય નો સીધોસાદો મંત્ર સ્મરી એને ભજી લેવાનો છે. અન્ય દેવી દેવતા ઓનાં લાંબા લાંબા કર્મકાંડીય યજ્ઞ કે પૂજન વિધિ જેવું કંઈ જ કરવાનું નથી. ભગવાન શંકર તો ભક્તનાં ભાવથી રીજી જનારો છે તેને અન્ય કોઈ સાધનની જરૂર નથી પરંતુ આપણી પાસે તેને દેવા માટે શુદ્ધ ભાવ પણ ક્યાં છે તો ભાવનગરના આ શિવાલયના દર્શન કરી અને શુદ્ધ થઈ શુદ્ધ ભાવે આખલોલ મહાદેવ ને સ્મરીએ.તો આ વાત છે ભાવેણાના સૌથી પ્રાચીન મંદિર એટલે કે આશરે સાડા પાંચ હજાર વર્ષ પહેલા સ્વયમ પાંડવો એ જેની સ્થાપના કરી હતી એવા સ્વયંભૂ શિવલિંગની વાત અને ધર્મરાજ યુધિષ્ઠિર ના હાથે જેનો ધડશોપચાર વિધિથી પૂજન થયું હતું, એવા આ શિવલિંગ ના દર્શન માત્રથી આપણા ત્રણે કાળના પાપનો નાશ થાય છે. તેમજ એક અદ્ભુત ઉર્જાનો અનુભવ થાય છે. તો આ શ્રવણે આપણે આ રીતે આ શિવાલયનો ઇતિહાસ જાણીશું, અને સમય અનુકૂળ થતાં સૌ કોઈ તેના દર્શનનો લાભ લઈ મુદ પવિત્ર થઈશું, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.

આ મંદિર લાકડાનું બનેલું હતું, અને તેમાં અજાણી ભાષામાં લખાયેલો એક શિલાલેખ પણ છે. વારંવારના જીર્ણોદ્ધાર ને કારણે આજે તો હવે તેનું મૂળ સ્વરૂપ રહ્યું નથી. પ

રંતુ ભાવનગર નાં રાજા તખ્તસિંહજીએ અને પછી ત્યારબાદ કૃષ્ણકુમારસિંહજી એ તેનો જીર્ણોદ્ધાર કરેલો, અને તેની સાથે પણ એક દંતકથા જોડાયેલી છે. કહેવાય છે કે એકવાર મહારાજા તખ્તસિંહજી સિહોરથી ભાવનગર પાછા આવી રહ્યા હતા અને રસ્તામાં આવતા આખલોલ મહાદેવ માંથી બ્રાહ્મણોના મંત્રોચાર નો સુર તેના કાને અથડાયો અને આ ભાગમાં તેને અદભુત શાંતિનો અનુભવ થયો, હકારાત્મક ઊર્જા મહેસુસ થઈ હોવાથી તેમણે વિચાર્યું કે આ મંદિરમાં જઈ અને ભગવાન આશુતોષને પ્રાર્થના કરું કે અમારે આ વર્ષે ભાવનગરમાં વરસાદ થયો નથી તો, ભાવેણાની ધરા ને વરસાદથી પરિત્રમ કરે, સાથોસાથ તેમણે માનતા રાખી કે જો વરસાદ આવશે તો હું આ મંદીરનો જીર્ણોદ્ધાર કરીશ, અને હજી તો મહારાજા નિલમભાગ પેલેસ સુધી પણ પહોંચ્યા નહીં, ત્યાં આગળ ધોધમાર વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો અને એ રીતે આંખલોલ મહાદેવ નો જીર્ણોદ્ધાર થયો.

શ્રાવણ માસમાં શિવ મહિમા-૨ શિવલિંગ -પજનવિધિ વિશે જાણકારી



વિશેષ
યશપાલસિંહ ટી. વાઘેલા



મેઘરાજાના વિરામ વચ્ચે અધિક શ્રાવણ માસ પુરો થયો. ભગવાન સદા શિવ ભોળાનાથની ઉપાસના આરાધનાનો મહિનો શ્રાવણ માસ શરૂ થયો આજે બીજો દિવસ ગઈકાલે પાર્થિવ શિવલિંગ વિશે જાણકારી મેળવી શિવ મહિમા અંતર્ગત આપણે વિવિધરૂપે શ્રાવણ માસમાં શિવ મહિમા જોઈશું. તો આજે આપણે શિવ લિંગ વિશે જાણકારી-પૂજન વિધિ જોઈએ. શિવલિંગ વિશે જાણકારી શિવ નો અર્થ થાય છે કલ્યાણ કરનારા અને લિંગનો અર્થ થાય છે બનાવનાર. તેથી શિવલિંગ પૂજામાં આપને આપના સંપૂર્ણ જગતના નિર્માતા સર્વ શક્તિમાન શિવની પૂજા કરે છે. શિવલિંગ ભગવાન શિવની નિરાકાર રૂપ ની મહિમા ને દર્શાવે છે. શિવ આદિ, અનાડી છે અને અંત પણ છે. સંપૂર્ણ જગતનો આધાર છે શિવ. સંપૂર્ણ બ્રહ્માંડ લિંગ રૂપમાં છે અને જલધારી પૃથ્વી છે. શબ્દોના ઘણા અર્થ છે. કોટી નો અર્થ પ્રકાર પણ થાય અને કરોડ પણ થાય છે. એવી જ રીતે લિંગ શબ્દ ના અર્થ પણ ઘણા બધા થાય છે. તેને શિવલિંગ ના સર્બંધમાં જનનાંગ ના લેવો જોઈએ.

શિવની પૂજા શિવલિંગના સ્વરૂપે વર્ષોથી થતી આવી છે. રામાયણ અને મહાભારત કાળમાં પણ શિવલિંગ પૂજા વિશે જણાવેલ છે શિવલિંગ માં ત્રીદેવોની શક્તિ નિહિત છે. મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં વિષ્ણુ અને ઉપર ભગવાન શંકર. જલધારીના રૂપમાં શક્તિ. તેથી શિવલિંગની પૂજાથી દરેક દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. સમસ્ત દેવી દેવતાની પૂજાની સમાન છે શિવના નિરાકાર શિવલિંગની પૂજા. શિવલીંગની પૂજા કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ દરેકની પ્રાપ્તિ થાય છે. જ્યારે આ સંપૂર્ણ જગતનો નાશ થશે તો શિવલિંગ માં સમાઈ જશે અને પછી આ જ માટે અનેક મંગલ પવિત્ર શિવલેત્રો રચેલા છે. સરસ્વતી જે આઠ મુખ વાળી છે, તેના તટે વાસ કરવાથી બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે. સો મુખ વાળી ગંગા નદીના કાઠે વસેલું કાશી, જ્યાં પવિત્ર તીર્થો આવેલા છે. દસ મુખવાળી, શૌણભદ્ર, ચોવીસ મુખવાળી નર્મદા બાર મુખવાળી કૃષ્ણાવાણી, દસ મુખ વાળી, તુંગભદ્રા, નવ મુખવાળી, સુવર્ણમુખરી, સત્તાવીસ મુખવાળી, કાવેરી વગેરે નદીઓ પવિત્ર ગણાય છે અને તેના પવિત્ર તટે ધણા તિર્થસ્થળો આવેલા છે તે બધા સદાશિવના પવિત્ર તીર્થસ્થળો છે. ભગવાન સદાશિવે પૃથ્વી પર વસવાટ કરતા લોકોના મોક્ષ માટે અનેક મંગલ પવિત્ર શિવલેત્રો રચેલા છે. સરસ્વતી જે આઠ મુખ વાળી છે, તેના તટે વાસ કરવાથી બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે. સો મુખ વાળી ગંગા નદીના કાઠે વસેલું કાશી, જ્યાં પવિત્ર તીર્થો આવેલા છે. દસ મુખવાળી, શૌણભદ્ર, ચોવીસ મુખવાળી નર્મદા બાર મુખવાળી કૃષ્ણાવાણી, દસ મુખ વાળી, તુંગભદ્રા, નવ મુખવાળી, સુવર્ણમુખરી, સત્તાવીસ મુખવાળી, કાવેરી વગેરે નદીઓ પવિત્ર ગણાય છે અને તેના પવિત્ર તટે ધણા તિર્થસ્થળો આવેલા છે તે બધા સદાશિવના પવિત્ર તીર્થસ્થળો છે.

શ્રાવણ માસ શરૂ થયો અગાઉ અધિક શ્રાવણ માસ હતો એટલે શિવ મહિમા શિવાલયોમાં ચાલુ જ છે ભાવિક શિવ ભક્તિમાં આ વર્ષે અનેરો ઉત્સાહ ઉમંગ છે.

આ બે વસ્તુથી અટબક હેલ્થ બેનેફિટ્સ



લસણ અને મધ ખાવાના ફાયદા તો આપણે બધા જ જાણીએ છીએ અને બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ બંને વસ્તુઓનું સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર રહે છે. પરંતુ જ્યારે આ બંને વસ્તુઓ એક સાથે ખાવામાં આવે ત્યારે શું થાય છે? એવો સવાલ થયો છે? જ્યારે લસણ અને મધ બંનેને અલગ અલગ ખાવાથી આટલા બધા ફાયદા થતાં હોય છે, તો એનું એક સાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને કેટલો ફાયદો થઈ શકે છે એની કલ્પના જ કરવી રહી. લસણ અને મધ બંને ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે અને આ જ કારણ છે કે તેને ખાવાથી શરીરને પુષ્કળ લાભ મળી શકે છે. જો તમે ખાલી પેટે લસણ અને મધનું એક સાથે સેવન કરો છો, તો તમારી અનેક સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવું એટલા માટે છે કારણ કે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. આટલું જ નહીં, તેનું એકસાથે સેવન કરવાથી હૃદય સંબંધિત ઘણી ગંભીર બીમારીઓ પણ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ કે દરરોજ સવારે ખાલી પેટે લસણ અને મધનું સેવન કરવું જોઈએ.


છેતરાઈ ગયા છીએ એવું જાણ્યા બાદ આવેલું ડહાપણ શું કામનું?



તમને ક્યારેય એવું લાગે છે કે તમે સંબંધમાં છેતરાઈ રહ્યા છો? તમારા ગમતાં લોકો જ તમારી સાથે ગેમ રમી રહ્યા છે? શું તમારી લાગણીઓનો સામે પક્ષે ઉપયોગ થઈ રહ્યો છે? જો હા, તો આ લેખ તમારા માટે જ છે. આપણાં મનગમતાં સંબંધો મનને ઉત્તરડા આપી રહ્યાની જાણ હોવા છતાં એને નથી છોડી શકતાં, કારણ કે કેટલાક સંબંધો હોય જ છે એવા કે નથી તોડી શકતાં કે નથી એનાથી દૂરી સહન થતી. આ સંબંધ એકાંતમાં જેટલી તકલીફ આપે છે એટલી તકલીફ જાહેરમાં પણ અન્ય કોઈ સંબંધ થકી નથી મળતી. આ જાણતા હોવા છતાંય આપણે જાણીજોઈને આપણી જાતને ખાડામાં નાખીએ છીએ અને પછી અન્ય પર દોષારોપણ કરીએ છીએ. હકીકતમાં અહીં ખામી આપણામાં છે, તકલીફ આપણી છે કે આપણે પરિસ્થિતિ પ્રમાણે ઢળી નથી શકતાં. સામેવાળાને જ્યાં સુધી આપણે યુઝફૂલ હતાં ત્યાં સુધી એના માટે આપણે ટોપ મોસ્ટ પ્રાયોરિટીમાં હતાં, પણ જેવા આપણે નકામાં બની ગયાં અથવા તો એ વ્યક્તિ આપણાથી ઉભાઈ ગઈ એટલે તરત જ સંબંધમાં વળતાં પાછી શરૂ થાય છે અને એ પણ એમની સાઈડથી, કારણ કે આપણું સ્ટેન્ડ તો કલીયર હોય છે. કંઈપણ થાય આપણે તો બસ નિભાવવું જ છે. આપણે તો મહાન બનીને, દર્દ સહન કરીને, કોઈપણ ભોગે એ વ્યક્તિ સાથેના સંબંધ જાળવી રાખવા છે. આ બાબત

માટે એટલા સસ્તાં પણ ન બનીએ કે લોકો સાવ મક્કમાં માગી જાય. આપણા એક એક શબ્દની વેલ્યુ હોવી જોઈએ. આપણી એક એક મિનિટ જ્યાં ઈન્વેસ્ટ કરીએ છીએ એનું રિટર્ન મળવું જોઈએ. આપણી યાદોમાં જેનું સ્થાન કાયમ છે એની નજરમાં આપણું સ્થાન ઊંચું હોવું જરૂરી છે. જો એમ નથી તો આવો સંબંધ આપણા માટે વોનિંગ બેલ સમાન છે, પણ આપણા બધાની તકલીફ એ છે કે આપણને સતત કોઈની હાજરી જોઈએ છે. આપણે સતત કોઈનો સાથ ઝંખીએ છીએ. અન્ય સામે આપણે કેટલાં કાબિલ અને જ્ઞાની છીએ એ પ્રદર્શિત કરવા માગીએ છીએ અને આમ કરવાનું રીઝન એ છે કે આપણને સતત કોઈનું એટેન્શન મળી રહે એ ગમતું હોય છે. એ મેળવવા માટે થઈને કોઈ આપણી સાથે ખોટી હમદર્દી બતાવી જાય તો પણ એ ઓળખવાની ક્ષમતા આપણે ગુમાવી દીધી હોય છે. આપણા દિલને પેમ્પર કરવાવાળું ન હોય તો જાણે હાઈએટેક આવે એ હાઈ નાસીપાસ થઈ જતાં હોઈએ છીએ. અરે થોડાંક સમય માટે પણ એકલું રહેવાનું થાય તોય જાણે ગમગીનીની યાદરમાં લપેટાઈ ગયાં હોઈએ એવી લાગણી થાય છે. આપણને કોઈ છેતરી ગયું, આપણે ઉપયોગ થઈ ગયો, આપણી સાથે ગેમ રમાઈ ગઈ, આવું કહેતાં પહેલાં વિચારવું કે આમ કરવાનો અધિકાર આપનાર આપણે જ હતાં. એ વ્યક્તિ આપણી મરજીથી આગળ વધી હતી.

એકલતા બની શકે છે એક શ્રાપ



આ પૃથ્વી પર લગભગ ૮ અબજ મનુષ્ય વસે છે. આટલી આબાદી હોવા છતાં કોઈનું કોઈની સાથે જામતું નથી. બધા જ પોતપોતાના સ્વાર્થ ખાતર જીવે છે. માટે જ કુટુંબમાં, પાડોશમાં, સમાજમાં અને બે દેશ વચ્ચે હંમેશાં ઘર્ષણ રહ્યા કરે છે. પરિણામ સ્વરૂપે લગભગ બધા પોતપોતાના વાડા બનાવીને સંકુચિત જીવન જીવતા થઈ ગયા છે. આ દુનિયામાં લાખો-કરોડો વ્યક્તિઓ હોવા છતાં, લોકો એકલા પડી જાય છે. એકલાપણું એક માનસિક મહારોગ છે અને નાની-મોટી બીમારીના બીજ વાવે છે. એકલતા એક સામાજિક સમસ્યા પણ છે. જે વ્યક્તિ કોઈ કારણવશ એકલા પડી જાય છે, તેઓ સમાજમાં ઢળી મળી શકતા નથી, કોઈ પણ સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી અને સામાજિક વ્યવસ્થા પર બોજ બનીને રહી જાય છે. એકલતાના ગણ મુખ્ય પ્રકાર છે. (૧) ઈમોશનલ લોન્લીનેસ (લાગણીની એકલતા):- આવા વ્યક્તિઓ કોઈની સાથે આત્મિયતા સાધી શકતા નથી, મનની વાત કહી શકતા નથી. કોઈની સાથે તેઓ આત્મસંબંધ બાંધી શકતા નથી. ઘણી વખત પતિ-પત્ની વચ્ચે પણ આત્મિયતા હોતી નથી અને માત્ર ઔપચારિક વ્યવહાર હોય છે. લાગણીની એકલતા એ જ ડાઈવોર્સનું મુખ્ય કારણ છે. (૨) સોશિયલ લોન્લીનેસ (સામાજિક એકલતા):- આવા વ્યક્તિનું સામાજિક વર્તુળ નહીં બરાબર હોય છે. ઘરથી કામ સુધી અને પછી કામથી ઘર એજ એમની પ્રવૃત્તિ. એમનાં કોઈ ખાસ મિત્રો હોતા નથી અને તેઓ કોઈ સામાજિક કાર્યમાં જોડાતા નથી. પોતાનું ઘર પીંજરા સમાન બની જાય છે. (૩) એકિસ્ટેન્શિયલ લોન્લીનેસ (વિશ્ર્વ એકલતા):- આવા વ્યક્તિ નિરર્થક જીવન જીવતા હોય છે. તેમને આ જીવનનો હેતુ શું છે એ જ સમજાતું નથી. માટે કોઈ પણ પ્રવૃત્તિમાં તેઓ રસ લેતા નથી. તેમને બધી જ રીતે વાંધો હોય છે અને સત્યનો સ્વીકાર કરી શકતા નથી. તેઓ વિકૃત હૃદ અને વટથી ભરેલા હોય છે અને એકલવાયું જીવન જીવે છે.

એસીની બાજુમાં ટીવી હોય તો થઈ જશે એલર્ટ, બૂમરાડ પડાવી દે તેવો ખર્ચો માથે પડશે

ભીષણ ગરમી સામે લડવા માટે ઘણા લોકો Air Conditioners ઉપયોગ કરે છે. તેની માંગ દિવસે દિવસે વધી રહી છે. પરંતુ એસીના વધારે ઉપયોગથી લોકોના મનમાં માત્ર વધતા વીજળી બિલનું ટેન્શન આવી જાય છે. જ્યારે જો એસીની આસપાસ કોઈ ટીવી કે ડિવાઈસ લાગેલું છે, તો તે એસી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં એસી લગાવતા સમયે ઘણી વાતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. જો કંઈક ભૂલ થઈ જાય તો તમારા એસીના ફૂલિંગ પર અસર પડે છે. એસી યોગ્ય રીતે કામ કરે. તેના માટે તેની



સારસંભાળ રાખવી બહુ જ જરૂરી છે. તેના ફિલ્ટરને હંમેશા સાફ કરવું જોઈએ. ગરમીથી રાહત મેળવવા માટે એસીને કયા મોડ પર ચલાવવું, આવી તમામ બાબતોનું ધ્યાન રાખવું, યારે તમારા ઘરે AC લગાવો ત્યારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે દીવાલ પર તમે એસી ફિટ



કરાવી રહ્યા હોવ ત્યારે તેની આસપાસ કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ કે અપ્લાયન્સ ન લગાવવું જોઈએ. કોઈ પણ હીટ પેદા કરવાનું અને પાવર કન્વર્ટ કરનારું ડિવાઈસ નહીં લગાવવું જોઈએ. આમાં LED ટીવી, કમ્યુટર, જેવી તમામ વસ્તુઓ સામેલ છે. તેને ક્યારેય પણ



એસીની આસપાસ ઈન્સ્ટોલ ન કરવું જોઈએ. ટીવી જેવા અપ્લાયન્સને એસીની આસપાસ લગાવવાથી એર કન્ડીશનરની સિસ્ટમ પરફોર્મન્સ બગડી શકે છે. તેની સાથે-સાથે તે યૂનિટનું ઈન્ડોર અને આઉટડોર બંને પર ખરાબ અસર પડી શકે છે. એવામાં એસીને હંમેશા આ



ડિવાઈસથી દૂર રાખો. ફિલ્ટરને સાફ કરો- વરસાદની સિઝનમાં એક અન્ય વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હંમેશા તેના ફિલ્ટરની સફાઈ કરતા રહેવું જોઈએ. જો તમે ઓછામાં ઓછા ૨ સપ્તાહમાં સાફ નહીં કરો તો, ધૂળ અને માટી ફિલ્ટર પર જામી જવાનું જોખમ રહેશે.

BOLLYWOOD NEWS FLASH

અંકિતા લોખંડેએ હંમેશા સપોર્ટ કરવા તેમજ સપનાઓની ઉડાન ભરવા દેવા માટે પિતાનો આભાર માન્યો હતો



અંકિતા લોખંડેએ દિવંગત પિતા માટે લખી ભાવુક કરનારી વાત

૧૨ ઓગસ્ટના રોજ 'પવિત્ર રિશ્તા' ફેમ અંકિતા લોખંડેના પિતા શશીકાંત લોખંડેનું નિધન થયું હતું. તેમની ઉંમર ૬૮ વર્ષ હતી અને તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. ૧૫મી ઓગસ્ટે પિતાને યાદ કરતાં એક્ટ્રેસે એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમની પરિવાર સાથેની કેટલીક યાદોની તસવીરો હતી. આ સાથે તેણે પિતાના નિધન બાદ પરિવારના સભ્યો અને મિત્રો પાસેથી તેમના વિશે કેટલું બધું જાણવા મળ્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું 'હેલ્થો ડેડી, હું તમને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી પરંતુ હું તેમ કહેવા માગું છું કે, મેં મારા જીવનમાં ક્યારેય પણ આટલી મજબૂત, એનર્જેટિક અને અદ્ભુત વ્યક્તિ જોઈ નથી'. આગળ તેણે લખ્યું હતું 'જ્યારે તમે અમને છોડીને ગયા ત્યારે તમારા વિશે વધારે જાણવા મળ્યું. દરેક વ્યક્તિ જે તમને મળવા આવતી હતી, તેમણે તમારા વખાણ કર્યા હતા, જેમ કે તમે કેવી રીતે દરરોજ તેમને ગુડ મોર્નિંગના મેસેજ મોકલતા હતા, કેવી

અસલી ગદર તો ગુરુદાસ માનની હતી, ફિલ્મે જીત્યો હતો નેશનલ એવોર્ડ

૧ મુંબઈ, તા.૧૭ | સની દેઓલ અને અમીષા પટેલની 'ગદર ૨'ની ચારે તરફ ધૂમ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મ અનિલ શર્માની વર્ષ ૨૦૦૧માં આવેલી 'ગદર: એક પ્રેમ કથા'ની સીકવલ છે, જેમાં પાકિસ્તાન અને ભારતના ભાગલાના દર્દ અને તકલીફ વચ્ચે પ્રાંગરતી લવસ્ટોરીને દર્શાવાઈ છે. 'ગદર ૨'એ એક તરફ થિયેટર્સની રોનક પાછી લાવી દીધી છે, તો બીજી પક્ષ એવો પણ છે કે કેટલાક લોકોને આ કહાણી પસંદ નથી આવી. કેટલાક તેને 'ગદર: એક પ્રેમ કથા' કરતા નબળી જણાવી રહ્યા છે. જોકે, આજે આપણે તેના વિશે વાત નથી કરવાના, પરંતુ આપણે અસલી 'ગદર' હીરો બૂટા સિંહની કહાણી જાણવાની છીએ. એ બૂટા સિંહ, જે



અસલી 'તારા સિંહ' હતા, જેમણે પોતાના પ્રેમ માટે પોતાને પાકિસ્તાનમાં કુરબાન કરી દીધો હતો. આ હીર-રોંગા જેવી લવસ્ટોરી પર ૨૪ વર્ષ પહેલા એક પંજાબી ફિલ્મ બની હતી. જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

તેમાં બૂટા સિંહની કહાણીને કોઈ ફેરફાર કર્યા વિના દર્શાવાઈ હતી. જેમ 'ગદર: એક પ્રેમ કથા'માં તારા સિંહ ભારત-પાકિસ્તાનના ભાગલા વચ્ચે સકીનાનો જીવ બચાવ્યો હતો અને પછી બંનેને પ્રેમ થઈ ગયો હતો. તદ્દન એવી જ રીતે બ્રિટિશ આર્મીના ભારતીય સોલ્જર બૂટા સિંહને પણ જેનબ નામની પાકિસ્તાની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેએ લગ્ન કર્યા અને એક દીકરીનો જન્મ પણ થયો. પરંતુ બંનેને તોફાનો અને ભારત-પાકિસ્તાનના ભાગલની આગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરિણામ એ આવ્યું કે, બંને જુદા પડી ગયા. બૂટા પોતાની જેનબ માટે મુસ્લિમ પણ બની ગયા. તેઓ પાકિસ્તાન પણ ગયા, પરંતુ તેમને તેમનો પ્રેમ ન મળી શક્યો.

દીપિકા કક્કરે પોતાના દીકરા રુહાન સાથે સેલિબ્રેટ કર્યો સ્વતંત્રતા દિવસ, હાથ પકડી લહેરાવ્યો તિરંગો હતો

દીકરા સાથેની ક્યૂટ તસવીર પર આવ્યું દીપિકા કક્કરના ફેન્સનું દિલ


૧ મુંબઈ, તા.૧૭ | દીપિકા કક્કરે શોએબ ઈબ્રાહિમ સાથેના લગ્નજીવનના પાંચ વર્ષ બાદ પહેલીવાર મા બની છે. તે પોતાના દીકરા રુહાનના પહેલા દરેક પ્રસંગ અને ફેસ્ટિવલને ખાસ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે, રુહાન બે મહિનાનો થવા આવ્યો છે અને તેનો જન્મ ૨૧ જૂનના રોજ થયો હતો. ૧૫મી ઓગસ્ટે મંગળવારે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એક્ટ્રેસે પણ ઉજવણી કરી હતી. સૌથી ખાસ વાત તો એ હતી કે, નાનકડા રુહાને પણ પોતાના નાનકડા હાથથી તિરંગો લહેરાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ખૂબ ઓછી એક્ટિવ રહેતી દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરા સાથેની તસવીર શેર કરી હતી અને બધાને શુભેચ્છા પાઠવી હતી. દીપિકા કક્કરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર શેર કરી હતી. જેમાં તે વ્હાઈટ કલરના પેલ્લમ ટોપ અને પ્લાઝોમાં જોવા મળી, આ સાથે તેણે મેથિંગ દુપટ્ટો પણ નાખ્યો હતો. તેણે પોતાના વાળ મુલ્લા રાખ્યા હતા, લાઈટ મેકઅપ કર્યો હતો અને કાનમાં સિલ્વર ઝુમકા પહેર્યા હતા. દીકરો રુહાન તેના ખોળામાં જોવા મળ્યો, તેણે પેરટ ગ્રીન કલરની ટીશર્ટ અને ડેનિમ શોર્ટ પહેરી હતી. દીપિકાએ રુહાનનો હાથ પકડીને તિરંગો લહેરાવતો દેખાવ્યો. આ સાથે તેણે 'હૃદયી ઈન્ડિપેન્ડન્સ ડે' લખ્યું હતું અને રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું હતું. નહાંદ સબા ઈબ્રાહિમે પણ પ્રેમ વરસાવતા રેડ હાર્ટ ઈમોજી મૂક્યું હતું.



હવે ભૂલથી પણ કોઈ કેનેડા કુમાર નહીં કહે!, ૨૦૧૯ સિટિઝનશિપ મેળવવાનો કરી રહ્યો હતો પ્રયાસ

અભિનેતા અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા

૧ મુંબઈ, તા.૧૭ | કેનેડાની નાગરિકતા ધરાવતા બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને ફરીથી ભારતીય નાગરિકતા મળી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર અક્ષય કુમારે દિવર પર આ પુરાવો મેળવવાનો કરી રહ્યો હતો પ્રયાસ તેના તમામ ફેન્સ અને દેશવાસીઓ સાથે શેર કરી છે. અક્ષય કુમારને ઘણીવાર 'કેનેડા કુમાર' કહીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતો હતો. ભારતમાં ટેક્સ ચૂકવતી વખતે પણ તેની પાસે કેનેડાની નાગરિકતા હતી. ઘણા સમયથી અક્ષય કુમાર ભારતની નાગરિકતા મેળવવાની કોશિશ કરી રહ્યો હતો અને આખરે તેણે સ્વતંત્રતા દિવસ પર ભારતની સિટિઝનશીપ મળી ગઈ. આ પુશી શેર કરતા અક્ષયે ટ્વીટ કરીને લખ્યું કે, Dii aur citizenship, dono Hindustani. Happy Independence Day! Jai Hind! જણાવી દઈએ કે કેનેડાની નાગરિકતા પહેલા પણ અક્ષય પાસે ભારતની નાગરિકતા હતી. જ્યારે ફિલ્મો સારી ચાલી રહી ન હતી ત્યારે અક્ષય કેનેડામાં રહેવાનું વિચારી રહ્યો હતો. અક્ષયે વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે, 'થોડા વર્ષો પહેલા મારી ફિલ્મો સારી ચાલી રહી ન હતી અને લગભગ ૧૪-૧૫ ફિલ્મો ફ્લોપ રહી હતી, તેથી મેં વિચાર્યું કે કદાચ મારે બીજે જઈને કામ કરવું જોઈએ.' જો કે, કેનેડાની નાગરિકતા અંગે સતત ટીકાઓનો સામનો કરી રહેલા અક્ષયે વર્ષ ૨૦૧૯માં જ ભારતીય નાગરિકતા પાછી મેળવવા માટે અરજી કરી હતી. અક્ષયે કહ્યું હતું કે, 'મારા માટે ભારત જ સર્વસ્વ છે, મેં જે કંઈ કમાવ્યું છે, જે કંઈ મેળવ્યું છે તે અહીંથી છે. અને હું ભાગ્યશાળી છું કે મને પરત આપવાની તક મળી. જ્યારે લોકો કંઈપણ જાણ્યા વિના કંઈપણ કહે ત્યારે તમને ખરાબ લાગે છે. ૧૯૯૦ના દાયકામાં અક્ષયની સતત અનેક ફિલ્મો ફ્લોપ ગઈ. તેણે જણાવ્યું કે તેની ફિલ્મોના નબળા બોક્સ ઓફિસ પરફોર્મન્સે તેને કેનેડાના નાગરિકતા માટે અરજી કરવા પ્રેરિત કર્યો. અક્ષયે કહ્યું, 'મેં વિચાર્યું કે મારી ફિલ્મો નથી ચાલી રહી અને મારે કામ કરવું પડ્યું. હું કામ માટે ત્યાં ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેણે કહ્યું - અહીં આવો. મેં અરજી કરી અને હું નીકળી ગયો. તેણે વધુમાં કહ્યું કે, 'મારી પાસે માત્ર બે જ ફિલ્મો રિલીઝ થવાની બાકી હતી અને તે નસીબની વાત છે કે તે બંને સુપરહિટ બની.



ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

જસદણના સર્કિટ હાઉસ પાસે એસ.ટી.નો સ્ટોપ મળતાં લોકોમાં આનંદની લાગણી : શામજી ડાંગરની સફળ રજુઆત

હુસાયીન કપાસી

૧ જસદણ, તા.૧૭

જસદણમાં આઝાદી પછી સર્કિટ હાઉસ પાસે એસ ટી બસને સ્ટોપ મળતાં અહીંના સ્થાનિક લોકોમાં ભારે આનંદ છવાયો હતો જસદણમાં વાજસુરપરા, કમળાપુરરોડ, વીંછિયારોડ પરના ૧૯ જેટલાં વિસ્તારોના હજાર જેટલાં લોકોને દરરોજ બહારગામ જવા માટે તેમને છે ક બે કિલોમીટર દુર બસ સ્ટેન્ડ પર જવું પડતું હતું પરંતુ જસદણના સામાજિક કાર્યકર શામજીભાઈ ડાંગરની રજુઆતનો, જબરો પડઘો પડતા આખરે જસદણના સર્કિટ હાઉસ પાસે નીકળતી દરેક એસ ટી ને સ્ટોપ ફાળવવામાં આવતાં આખરે લોકોને હાશકારો થયો હતો આ અંગે શામજીભાઈ ડાંગરએ જણાવ્યું હતું કે જસદણને જોડતાં અનેક વિસ્તાર સર્કિટ હાઉસની નજીક આવેલ હોય અને હાઈ વે હોવા



છતાં કોઈ એસ ટી અહીં ઊભી રાખવામાં આવતી નહોતી આથી મે માનનીય મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજુઆત કરેલ કે સર્કિટ હાઉસ નજીક મોટી માનવ વસાહત હોય આમ છતાં કોઈ કારણોસર પેસેન્જર લેવામાં આવતા નથી આથી મંત્રીએ અમારી યોગ્ય માંગણી યોગ્ય જગ્યાએ રજુઆત કરી અને વર્ષો જુની માંગણી અમારી પુરી પાડવામાં આવતાં હું કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટ અને જસદણ ડેપુટી અધિકારીઓ ભાજપના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરું છું.

પૂર્વ તટ રેલવેમાં નોન-ઇલેક્ટ્રીકાઇઝેશન કાર્યને હોવાના કારણે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ અને અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે

૧૨૯૮૪ પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

૩. ૧૭, ૨૨, ૨૪ અને ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ ની ટ્રેન નંબર ૨૦૮૨૪ અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

૮. ૧૭, ૨૧, ૨૪ અને ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ ની ટ્રેન નંબર ૨૦૮૨૩ પુરી-અજમેર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

૫. ૧૮ અને ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ ની ટ્રેન નંબર ૧૨૯૮૩ ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

૬. ૨૧ અને ૨૮ ઓગસ્ટ ૨૦૨૩ ની ટ્રેન નંબર

૧૨૯૮૪ પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

૩. ૧૭, ૨૨, ૨૪ અને ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ ની ટ્રેન નંબર ૨૦૮૨૪ અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

૮. ૧૭, ૨૧, ૨૪ અને ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ ની ટ્રેન નંબર ૨૦૮૨૩ પુરી-અજમેર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

૫. ૧૮ અને ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ ની ટ્રેન નંબર ૧૨૯૮૩ ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

૬. ૨૧ અને ૨૮ ઓગસ્ટ ૨૦૨૩ ની ટ્રેન નંબર

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ‘આરોગ્ય સેનાની’ ઓનું સન્માન

૧ સુરત, તા.૧૭

સુરત જિલ્લાના ઓલ પાડ ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સુરતની નવી હોસ્પિટલથી થતી અંગદાનની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાંચ આરોગ્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ.ગણેશ ગોવેકર, RMO ડૉ.કેતન નાયક, ડી.બી વિભાગના વડા ડૉ. પારૂલ વડગામા, પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડૉ.નિલેશ કાછડિયા, ઈસ્ટ વિભાગના ઈન્ચાર્જ ઈકબાલ કડીવાલાને



તેમની પ્રેરણાત્મક કામગીરી બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ઇલ્લા ૯ મહિનામાં નવી સિવિલ હોસ્પિટલ-સુરત ખાતેથી ૪૦ અંગદાન કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૧૩૮ અંગો પૈકી સૌથી વધુ ૭૬ કિડની, ૨૯ લિવર, ૨ હૃદય, ૪ સ્વાદુપિંડ, ૭ હાથ, ૧૮ પેશી અને ૨ ફેફસાના દાનનો સમાવેશ થાય છે.

ભરૂચ નર્મદા એપાર્ટમેન્ટ ખાતે જર્જરીત મકાન ધરાસાઈ થતા એક વ્યક્તિનું મોત ચાર દશક જુના એપાર્ટમેન્ટને તોડી પાડવા ૩ વર્ષ પહેલા જ ક્વાયત ધરાઈ હતી

૧ કેતન મહેતા ભરૂચ, તા.૧૭

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે જર્જરિત ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી.



નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૨૦ માં જ ૫૦૦ પરિવારોને ચાર દશક જુના એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસો બજાવ્યાં હતા. સમયાંતરે નોટિસો અને પાલિકા દ્વારા તેમના નળ જોડાણ કાપવાની તાકીદ છતાં કેટલાક પરિવારોએ જોખમી ફ્લેટ ખાલી કર્યા ન હતા. ભરૂચ પાલિકા એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઈમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસો તો આપે છે. પણ આ નોટીસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. મકાનમાલિકો પણ તંત્રની કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી આજની ઘટના જેવા માઠા પરિણામ સામે આવે છે. આજે વહેલી સવારે બનેલી ઘટના બાદ કાટમાળ હટાવવો ખુબ મુશ્કેલ બની રહ્યો હતો. ભરૂચ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી વીજળીના લટકતા વીજ વાયર

દૂર કરી સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રખાયું હતું. આ ઘટનામાં ટેલરીંગનું કામ કરી ગુજરાત યલાવતા આશરે ૩૮ વર્ષીય પંકજ જશવંતભાઈ ચૌહાણનું દબાય જવાથી મોત નીપજ્યું હતું. અન્ય પરિવારજનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે ઈસમોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ મામલે ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને તે યોગ્ય ન હોવાનો રોષ લોકોમાં ઉદ્ભવે છે. જર્જરિત ઈમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. જાણવા મળ્યા અનુસાર જર્જરીત નર્મદા એપાર્ટમેન્ટના રહિશોને નોટીસો અપાતા ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે પણ ખાલી કરવા મુદ્દે વિવાદ ઊભો થયો હતો. પરંતુ ૧૫ દિવસ અગાઉ જ ગુ.હા.બોર્ડના અધિકારીઓ સાથે થયેલ એક મીટીંગમાં તમામ નર્મદા એપાર્ટમેન્ટના રહિશો એ ખાલી કરવા સંમત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિર ખાતે ૨૦મી ઓગષ્ટના રોજ શ્રદ્ધા અને સબુરીના પ્રતીક સમા શ્રી સાંઈ બાબાના નવનિર્મિત મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

૧ ભરૂચ, તા.૧૭

ઇલ્લા કેટલાક વર્ષોથી ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલું શ્રી જલારામ બાપાનું મંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે તેમાં એક નવા સોપાનનો ઉમેરો થવા જઈ રહ્યો છે એટલે કે ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિર ખાતે આગામી નિજ શ્રાવણ સુદ ચોથ એટલે કે આગામી તા.૨૦ મી ઓગષ્ટને રવિવારના રોજ શ્રી સાંઈ બાબાના નવનિર્મિત મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિર ખાતે મોટા ભાગના તમામ મુખ્ય દેવી-દેવતાઓ જેવા કે શંકર-પાર્વતી, રાધા-કૃષ્ણ, સીતા-રામ, નવગ્રહ, ભાથીજી મહારાજ, બાળિયા દેવ, ગાયત્રી માતા, હરસિદ્ધિ માતા, અંબા માતા અને મૂળનાયક શ્રી જલારામ બાપાની મૂર્તિ આવેલી છે. પરંતુ સાંઈ બાબાની મૂર્તિ આવેલી નથી, માટે ગાયત્રીનગરના રહીશોએ સાંઈ બાબાના દર્શન માટે દૂર સુધી ચાલીને જવું પડે છે. માટે ગાયત્રીનગરના રહીશોની ઘણાં લાંબા સમયથી માંગ હતી કે ગાયત્રીનગરમાં



આવેલા શ્રી જલારામ બાપાના મંદિર ખાતે સાંઈ બાબાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે. પરંતુ હવે તેમની માંગણી ટુંક જ સમયમાં પૂરી થશે તેવું લાગી રહ્યું છે કારણ કે ગાયત્રીનગરમાં આવેલા શ્રી જલારામ બાપાના મંદિર ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી નિજ શ્રાવણ સુદ ચોથ એટલે કે તા.૨૦ મી ઓગષ્ટને રવિવારના રોજ સાંઈ બાબાના નવનિર્મિત મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. જેથી ગાયત્રીનગરના રહીશોને હવે ઘર આંગણે જ સાંઈ બાબાના દર્શન થશે, તો આ રૂડા અવસરમાં સહભાગી થવા માટે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

પ્રાંત ઓફિસરશ્રીની અધ્યક્ષતામાં સૂઘગામ ખાતે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ તાલુકા કક્ષાના કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરાઈ

૧ પાલનપુર, તા.૧૭

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારથી માંડી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત પૂરો જિલ્લો હાલમાં દેશભક્તિના રંગે રંગાયો છે ત્યારે સરહદી સૂઘગામ ખાતે પ્રાંત ઓફિસરશ્રીની અધ્યક્ષતામાં સૂઘગામ તાલુકા કક્ષાના કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત અધ્યક્ષશ્રી દ્વારા શિલાલકમનું પૂજન અર્ચન કરી અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ સૂઘગામ તાલુકાના જલોયા ગામના-૨ અને લીંબળાના-૧ શહીદ વીરો અને તમામ આઝાદીના લડવૈયા અને શહીદો સહિતને શ્રદાંજલિ આપીને

તેમના કુટુંબીજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સ્થાનિક આગેવાનો દ્વારા ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત તમામ દ્વારા પંચ પ્રાણ પ્રતિષ્ઠા લઈ ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા ઉલ્થ ઓફિસરશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શ્રી રામસંગભાઈ રાજપૂત, સૂઘગામ પી.એસ.આઈ.શ્રી સહિત પોલીસ જવાનો, સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામજનો, મહર્ષિ કણાદ શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર હાજર રહી કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરી હતી.

આજનું રાશિ ભવિષ્ય.....

મેષ (મ,લ,ઇ) : આજના દિવસે તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જા વાળો. માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી. જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે.

વૃષભ (બ,વ,ઘ) : આજના દિવસે જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભય ખુશી તથા મોજમજા. જે લોકોએ કોઈ થી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલત માં ઉધાર ચુકવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા, નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે.

સિંહ (મ,ર) : આજના દિવસે કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે- જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. જે લોકો શેરબજાર માં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે. સમય રહેતા સાવચેત થઈ જવું તમારા માટે સારું રહેશે? કુટુંબ ના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરી ને, તમે હળવાશ અનુભવો છો.

કન્યા (પ,ઘ,ણ) : આજના દિવસે તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજણ. આ રાશિ ના પરિણીત જાતકો ને આજે સાસરાપક્ષ થી ધન લાભ થવા ની શક્યતા છે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.

ધન (ભ,ધ,ફ) : આજના દિવસે એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલા વિચારજો. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે.

મકર (મ,જ) : આજના દિવસે તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કડ્ડણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો. એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે- એપછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે. આજે તમે જે લેન્કચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે.

મિથુન (ક,ઇ,ઘ) : આજના દિવસે તમારું શારીરિક સાર્થક જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવા ની શક્યતા છે. નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. ભવિષ્ય માં પણ મિત્રો મળી શકે છે.

તુલા (ર,ત) : આજના દિવસે તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તેમનો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આપમે પરત મળશે. કાનું ટેન્શન તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યું છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી.

કર્ક (સ,ઘ) : આજના દિવસે ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે.તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. તમારા ધન સંચિત કરવા ના પ્રયાસ આજે અસફળ થઈ શકે છે. પરંતુ ઘબરાવાની જરૂર નથી કેમકે પરિસ્થિતિ જલ્દી સુધરશે? જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે.

વૃશ્ચિક (ન,ય) : આજના દિવસે તમારો જીવિત અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજ દો, કેમ કે આ બાબત સમયનો નવો વેડફાટ છે. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માં થી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવન માં સ્થાન પણ આપી શકો છો? પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. રોમાન્સ માટે સારો દિવસ.

કુંભ (ગ,શ,સ) : આજના દિવસે તમે જે હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તોતમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. આજે તમે તમારા મકાન માં વેરવિખેર વસ્તુઓ ને ગોઠવવા ની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ઘણો વિશે તમને યાદ કરાવશે.

મીન (દ,ચ,ઝ,થ) : આજના દિવસે શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો? ગ્રહ નક્ષત્રો ની યજળવા થી તમારા માટે ધન કમાવા ની ઘણી તકો બનશે? રહેવાના સ્થળમાં પરિવર્તન ખાસ્સું મંગલકારી પુરવાર થશે. સમય બગાડવો એ સારી વસ્તુ નથી.

ઝાલોદ કોળીવાડા વિસ્તારમાં રાત્રીના સમયે મકાનની દિવાલ પડી જતાં એક મહિલા ઇજાગ્રસ્ત આજુબાજુ ના વિસ્તારના રહીશો દ્વારા તાત્કાલિક ૧૦૮ ને બોલાવી મહિલાને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાઈ

૧ પંકજ પંડિત ઝાલોદ, તા.૧૭

ઝાલોદ નગરના કોળીવાડા વિસ્તારમાં તારીખ ૧૬-૦૮-૨૦૨૩ ના રોજ અંદાજીત રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ એક કાચા મકાનની દિવાલ ઘસી નીચે પડી ગઈ હતી. જે મકાનની દિવાલ પડી ગયેલ હતી તે મકાન કાચું હતું. રાત્રિના સમય દરમ્યાન દિવાલ પડી તે સમયે એક મહિલા મકાનની અંદર હતી અને તે દિવાલ તે મહિલા ઉપર પડી ગયેલ હતી.



મહિલાપરદિવાલપડતાંત્યારંહેનારલોકોમાં ચીસાચીસ થઈ ગયેલ હતી તેથી તાત્કાલિક આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા અને દીવાલની નીચે દબાઈ ગયેલ મહિલાને તાત્કાલિક કાઢી લેવામાં આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ પણ સમયસર ત્યાં આવી ગયેલ હોવાથી ધાયલ મહિલાને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતી. હોસ્પિટલમાં હાજર સ્ટાફ દ્વારા ધાયલ મહિલાની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. હાલ ધાયલ થયેલ મહિલાની પરિસ્થિતિ

સારી હોવાનું સાંભળવા મળેલ છે. અત્રે એ નોંધનીય છે કે જે મકાનની દિવાલ પડી ગયેલ હતી તે મકાન જૂનું અને કાચી અવસ્થામાં કેટલાય સમયથી જોવા મળી રહેલ હતું. પરંતુ દિવાલ કેવી રીતે પડી ગઈ એ વાતને લઈ કોઈ વાતો જાણવા મળી રહેલ નથી અને જે દિવાલ પડી ગઈ હતી તે કેવી રીતે પડી તે તપાસનો વિષય છે.આ મકાનની દિવાલ પડતાં કોઈ મોટી જાનહાની સર્જઈ ન હતી અને મકાનમાં રહેતા લોકોનો આભાદ બચાવ થયેલ હતો.હાલ જાણવા મળેલ મુજબ મકાનની દિવાલ ધરાશાયી થયેલ હોવાથી મકાનનો કાટમાળ સાથે પડી ગયેલ જોવા મળી રહેલ છે.

“શાંતીરત્ન” ફાઉન્ડેશન લીમીડ દ્વારા દિવ્યાંગોની સહાય સાથે ૭૭મા સ્વતંત્રતા દિવસની ઉજવણી



૧ ઝાલોદ, તા.૧૭

આજ રોજ લીમીડ સ્થિત “શાંતીરત્ન” ફાઉન્ડેશન (સંચાલિત: શ્રી નેમચંદજી ગુલાબચંદજી ચેરીટેબલ ટ્રસ્ટ - લીમીડ) દ્વારા ૭૭ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે શાંતિરત્ન પટાંગણ વિનય પાર્ક ખાતે કરવામાં આવી. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ડો. હેડંગેવાર છાત્રાલય લીમીડના વિદ્યાર્થીઓ

તથા નગરજનોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે શાંતીરત્ન” ફાઉન્ડેશન લીમીડ દ્વારા જીલ્લાના વિવિધ ગામડાઓમાં વસતા ગરીબ અસહાય જરૂરિયાતમંદ ૭ (સાત) દિવ્યાંગોને ટ્રાઈસિકલ (ત્રણ પૈડા વાળી સાઈકલ) નું વિતરણ કરી તેમના જીવનમાં હલનચલનની પડતી મુશ્કેલીને કઈક અંશે ઓછી કરવાના ઉદ્દેશ સાથે આ સેવા કાર્ય પાર પાડેલ છે.

જિલ્લા કક્ષાના ૭૭મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઝાલોદ આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે વિજેતા થયા



૧ ઝાલોદ, તા.૧૭

ઢાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં માનનીય ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલેજના આચાર્ય મધુકર પટેલની આગેવાનીમાં સમસ્ત ઝાલોદ કોલેજના પરીવારે ઉમંગથી

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં લેફ્ટનન્ટ પ્રોફે. ડૉ. અજિતસિંહ પરમારના માર્ગદર્શનમાં NCCના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત ઉપર “એક પૈગામ દેશ કે નામ પોતાની કૃતિ રજૂ કરી હતી. આ કૃતિ એ સમસ્ત કાર્યક્રમમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જેને બિરદાવતા ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રીના હસ્તે ડૉ. અજિતસિંહ પરમાર અને એન. સી. સી. કેડેડ્સ નું સન્માન કરી સ્મૃતિ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુ તરફથી શ્રદ્ધાંજલિ અને સહાય

છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે જાનમાલનું બહુ મોટા પાયાનું નુકસાન થવા પામ્યું છે. તાજેતરના અખબારી અહેવાલો અનુસાર એકલા હિમાચલ પ્રદેશમાં જ ૭૦૦૦ કરોડ થી વધુ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સીમલા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદને કારણે જમીન અને મકાનોનું મોટે પાયે ધોવાણ થયું છે અને એને લીધે ૬૦થી વધુ લોકોના મૃત્યુ પણ થયા છે.



મૃત્યુનો કુલ આંકડો ઘણો વધે તેવી ભિંતી પણ સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ તમામ મૃતકોને એમની શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિજનોને ૧૫,૦૦૦ પ્રમાણે કુલ મળીને ૮ લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે.

યોગેશ ત્રિપાઠી ફોટો આલબમમાં જીવનની યાદો મઠી લે છે !



આજે લોકો ફેન્સી ફોન ફિલ્ટર્સનો ઉપયોગ કરીને સેલ્ફીઓ મઠી લે છે અને સોશિયલ મિડિયા પર તે શેર કરે છે. જોકે અભિનેતા યોગેશ ત્રિપાઠી માને છે કે જૂના જમાનાના ફોટો વિશે કાંઈક વિશેષ છે, જે ડિજિટલ મઠી શકતા નથી. આથી જ એન્ટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહની ભૂમિકા ભજવતો યોગેશ વર્લ્ડ ફોટોગ્રાફી ૩ નું નિમિત્ત સાધીને જૂના જમાનાની ફોટોગ્રાફીની સમકાલીન કળા થકી મજેદાર યાદોનું સંવર્ધન કરવાના પોતાના લગાવ વિશે વાત કરે છે. તેણે બહુ જ વડાલથી ખાસ ફોટો આલબમ બનાવીને પોતાના જીવનના પ્રવાસની રૂપરેખને કાળજીપૂર્વક જાળવી રાખી છે.

'હર ઘર તિરંગા' અભિયાન સાથે જોડાયા ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના નિવાસસ્થાને લહેરાવ્યો તિરંગો

દેશમાં ૧૫ ઓગસ્ટના રોજ ૭૭માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. PM નરેન્દ્ર મોદીના આહ્વાન પર આખા દેશમાં 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ક્યાં આમ ક્યાં ખાસ... હર ઘર તિરંગા અભિયાન, જે પૂરજોશમાં દેશભરમાં જોર શોરથી ચાલી રહ્યું છે. આ ક્રમમાં દેશના યશસ્વી ગૃહમંત્રી અમિત શાહે 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લીધો હતો અને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો. આ દરમિયાન તેમના પત્ની સોનલ શાહ પણ હાજર રહ્યા હતા. ગૃહમંત્રી શાહે દેશવાસીઓને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ પણ તેમના ઘરે તિરંગો ફરકાવે અને તેમની સેલ્ફી harghartiranga.com પર અપલોડ કરે તેવો અનુરોધ કર્યો હતો. શાહે તમામ દેશવાસીઓ અને સાથી નાગરીકોને તેમના



હર ઘર તિરંગા અંતર્ગત અભિયાન માટે પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તેમણે ભારતની એકતા અને ભાઈચારાની ભાવના સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તિરંગો ફરકાવ્યો હતો. ગૃહમંત્રીએ ટ્વીટ દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લેવા બદલ મળેલું પ્રશંસા પ્રમાણપત્ર પણ શેર કર્યું હતું.

યુનેસ્કોના સભ્યોએ ગુજરાત સાયન્સ સિટીમાં ચાલતા ક્લાઈમેટ ચેન્જ એજ્યુકેશન અંગે માહિતી મેળવી



સમગ્ર ભારતમાં અલગ અલગ સંસ્થાઓમાં ક્લાઈમેટ ચેન્જ અંગે કેવી રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેના વિશે પ્થાતનામ સંસ્થા યુનેસ્કો દ્વારા એક દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ સંદર્ભે યુનેસ્કો (દિલ્હી)ના સભ્યો અને CEE (Centre for Environment Education)ના તજજ્ઞોએ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી અને ક્લાઈમેટ ચેન્જ અંગે અપાઈ રહેલા શિક્ષણ વિશે માહિતી મેળવી હતી.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ક્લાઈમેટ ચેન્જ એજ્યુકેશન ચાલી રહ્યું છે. અહીંના એકપર્ટ દ્વારા યુનેસ્કો અને CEE ના સભ્યોને ક્લાઈમેટ ચેન્જ અને તેની અસરો અંગે સમજાવવામાં આવ્યું હતું. ક્લાઈમેટ ચેન્જને કારણે દેશ અને દુનિયામાં કેવા પ્રકારના ફેરફાર થાય છે અને તેને કારણે માનવ જીવન પર શું અસર થાય છે તેના વિશે એક્સપર્ટ વિસ્તૃતમાં સમજાવ્યું હતું. આ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહલ હાજર રહ્યા હતા. સાથે અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને પણ ક્લાઈમેટ ચેન્જ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદી પ્રયાસોથી પરંપરાગત ચિકિત્સાને પ્રોત્સાહન મળી રહ્યું છે : ડો. ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસ

ગાંધીનગરમાં ૧૭ ઓગસ્ટથી શરૂ થયેલી વિશ્વની પ્રથમ WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન WHO સેક્રેટરીજનરલ ડો. ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના સંબોધનમાં, તેમણે પરંપરાગત દવાના ક્ષેત્રમાં ભારતની ઐતિહાસિક પહેલની પ્રશંસા કરી અને કહ્યું કે આપણે પરંપરાગત, પૂરક અને સંકલિત દવા દ્વારા વિશ્વને સ્વસ્થ બનાવી શકીએ છીએ. તેમના સંબોધનમાં ડો. ટ્રેડોસે ખાસ કરીને તુલસીનો ઉલ્લેખ કર્યો, જે ભારતમાં દરેક ઘરમાં પૂજાય છે. તુલસીના ગુણોનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે મને તુલસીનો છોડ રોપવાનો મોકો મળ્યો. WHOના

પરંપરાગત દવા કોરોના જેવા સંકટનો સામનો કરવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. આ વિચારને અનુસરીને, તેમણે પરંપરાગત દવાના મિશન સાથે વિશ્વના અન્ય દેશોને જોડવાનું શરૂ કર્યું અને તેમની પહેલનું પરિણામ હવે વિશ્વની પ્રથમ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ તરીકે ઉભરી આવ્યું છે. નરેન્દ્રભાઈએ સંપૂર્ણ માનવજાત માટે ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ અને આયુર્વેદના જ્ઞાનની સમૃદ્ધિના વિરાસતને દેશ અને દુનિયા સામે ઉજાગર કરવાનું કામ કર્યું છે. વડાપ્રધાન વિશ્વની પીડાને ઓછી કરવા પ્રતિબદ્ધ છે. તેઓ ૨૧મી સદીના ભારતના અનુભવને અને જ્ઞાનને દુનિયા સાથે શેર કરી આગળ વધવામાં વિશ્વાસ રાખે છે.

પરંપરાગત દવા કોરોના જેવા સંકટનો સામનો કરવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. આ વિચારને અનુસરીને, તેમણે પરંપરાગત દવાના મિશન સાથે વિશ્વના અન્ય દેશોને જોડવાનું શરૂ કર્યું અને તેમની પહેલનું પરિણામ હવે વિશ્વની પ્રથમ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ તરીકે ઉભરી આવ્યું છે. નરેન્દ્રભાઈએ સંપૂર્ણ માનવજાત માટે ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ અને આયુર્વેદના જ્ઞાનની સમૃદ્ધિના વિરાસતને દેશ અને દુનિયા સામે ઉજાગર કરવાનું કામ કર્યું છે. વડાપ્રધાન વિશ્વની પીડાને ઓછી કરવા પ્રતિબદ્ધ છે. તેઓ ૨૧મી સદીના ભારતના અનુભવને અને જ્ઞાનને દુનિયા સાથે શેર કરી આગળ વધવામાં વિશ્વાસ રાખે છે.



પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી છે. મહાદેવના મંદિરમાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

દારુ પીને અબુધાબીના બે પેસેન્જરોની ફ્લાઈટમાં ધમાલ અબુધાબીથી માલદીવ્સના શહેર મેલ જઈ રહેલી ફ્લાઈટમાં બે પેસેન્જરો વચ્ચે બબાલ થઈ હતી

નવી દિલ્હી, તા. ૧૭ | એરલાઈનમાં મુસાફરોની ગેરવર્તણૂકના કિસ્સા કેટલીય વાર બન્યા છે. ક્યારેક કોઈ પેસેન્જર દારુના નશામાં અબદ વર્તન કરે કે હોબાળો મચાવે તો વળી કોઈ પેસેન્જર નજીબી બાબતે કેબિન કૂ સાથે ઝઘડી પડે, તો ક્યારેક બે પેસેન્જરો વચ્ચે બબાલ થઈ જાય છે. જેના લીધે ફ્લાઈટમાં રહેલા બીજા પેસેન્જરોને પણ હેરાન થવાનો વારો આવે છે અને તેમની મુસાફરી બગડે છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. હંગેરિયન એરલાઈન વિઝ એરની ફ્લાઈટમાં બે પેસેન્જરો વચ્ચે ઝઘડો થતાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદમાં કરવું પડ્યું હતું. અબુધાબીથી માલદીવ્સના શહેર મેલ જઈ રહેલી ફ્લાઈટમાં



બે પેસેન્જરો વચ્ચે બબાલ થઈ હતી. પરિસ્થિતિ વણસાતાં કેબિન કૂચે બંને પેસેન્જરોને શાંત કરાવવાની કોશિશ કરી ત્યારે તેઓ કૂ સાથે પણ ઝઘડી પડ્યા હતા. પાઈલટે આ બંને પેસેન્જરોને નિરંકુશ અને તોફાની ગણાવીને ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરી હતી. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસેથી પરવાનગી મળ્યા બાદ ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

અન્ય પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંને ઉદંડ મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર ઉતારી દેવાયા હતા અને ત્યાર પછી ફ્લાઈટ મેલ જવા રવાના થઈ હતી. આ બંને પેસેન્જરોને બાદમાં અબુધાબી પાછા મોકલી દેવાયા હતા. "આ ઘટના ચેતવણીરૂપ કિસ્સો છે તેમ કહી શકાય. પેસેન્જરોએ શિષ્ટાચાર જાળવવો જોઈએ. બાઇરૂમમાં સ્મોકિંગ અથવા તો કૂ સેમ્બર્સ સાથે ખરાબ વર્તણૂક જેવી હરકતો કરવાથી બચવું જોઈએ", તેમ એરપોર્ટના સુરોએ જણાવ્યું હતું. ફ્લાઈટનું વાતાવરણ ડોહાનારા આ પેસેન્જરો વિશે વાત કરીએ તો, ઉદ વર્ષીય ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસેથી પરવાનગી મળ્યા બાદ ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

ન્યૂઝ ડિસ્ક્રિબ્શન બાબકોના સ્વાસ્થ્ય ઉપર સ્માર્ટફોનની ખરાબ અસર

નવી દિલ્હી, તા. ૧૭ | કબીર દાસનો એક દોહો છે કે- અતિ કા ભલા ન બોલના, અતિ કી ભલી ન ચૂપ, અતિ કા ભલા ન ખરસના, અતિ કી ભલી ન ધૂપ. આ દોહો સ્માર્ટફોનના ઉપયોગના મામલામાં આ દોહો એકદમ ફિટ બેસે છે. આજના સમયમાં સ્માર્ટફોન ઉપયોગની અતિ થઈ રહી છે, જે તમને બીમાર બનાવી રહી છે. જેમ પરમાણુ બોમ્બની સાઈડ ઈફેક્ટ આજે પણ હિરોસિમા અને નાગાસાકીના બાળકોમાં જોઈ શકાય છે. આવી સ્માર્ટફોનની સાઈડ ઈફેક્ટ છે, જે બાળકોને માનસિક, શારીરિક રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. તેની અસર બાળકોની આખી જિંદગીમાં જોવા મળે છે. ઈન્ડિયન સ્પીચ એન્ડ હિયરિંગ એસોસિએશન એટલે કે ISHA એ હેલ્થ પાર્લિયામેન્ટની સાથે મળીને એક રોર ટૂ રોર સર્વે કર્યો છે. તેમાં દિલ્હી એનસીઆર અને જમ્મુ-કાશ્મીરના બાળકોને સામેલ કરવામાં આવ્યો છે.

રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી, EDએ આગોતરા જામીન અરજીને પડકારી વાડ્રાને આગોતરા જામીન આપતી વખતે ટ્રાયલ કોર્ટે આદેશ આપ્યો હતો કે તેઓ પૂર્વ પરવાનગી વિના દેશ છોડવાનું ટાળે

નવી દિલ્હી, તા. ૧૭ | કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને આપવામાં આવેલા આગોતરા જામીનને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કોર્ટમાં દાવો કર્યો છે કે રોબર્ટ વાડ્રાએ જામીનની શરતોનું પાલન કર્યું નથી. EDના વકીલે કહ્યું કે તેઓ જામીનની શરતોના ઉલ્લંઘનના કેસમાં કોર્ટમાં વધારાનું સોગંદનામું દાખલ કરશે. દિલ્હી હાઈકોર્ટે આ માટે EDને બે પડકારીયાનો સમય આપ્યો છે. આ મામલે હવે સાટેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. હકીકતમાં, દિલ્હી હાઈકોર્ટે ૧ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા રોબર્ટ વાડ્રાને આપવામાં આવેલા આગોતરા જામીનને પડકારતી EDની



અરજી પર સુનાવણી કરી રહી હતી. રોબર્ટ વાડ્રાને આગોતરા જામીન આપતી વખતે ટ્રાયલ કોર્ટે આદેશ આપ્યો હતો કે તેઓ પૂર્વ પરવાનગી વિના દેશ છોડવાનું ટાળે. આ ઉપરાંત તપાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવતા વાડ્રાને તપાસમાં ભાગ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. EDએ અગાઉ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તે વાડ્રાની ફરતીમાં પૂછપરછ કરવા માંગે છે અને આરોપ મુક્યો હતો કે આ કેસમાં નાણાંની લેવડદેવડ સીધી વાડ્રા સાથે સંબંધિત છે. એજન્સીએ એવી પણ દલીલ કરી હતી કે વાડ્રા તપાસમાં સહકાર આપવા આગળ નથી આવી રહ્યા. જવાબમાં, વાડ્રાના વકીલે EDના આરોપોને નકારી કાઢતા કહ્યું કે રોબર્ટ વાડ્રા તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને જ્યારે પણ તપાસ એજન્સી

હાઉસ વાઈફની જગ્યાએ હવે હોમ મેકર કોર્ટમાં અફેર શબ્દનો ઉપયોગ થઈ શકશે નહીં સુપ્રીમ કોર્ટે દલીલોમાં મહિલાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા આપતિજનક શબ્દોથી અંતર જાળવવા કહ્યું છે

નવી દિલ્હી, તા. ૧૭ | સુપ્રીમ કોર્ટના ચુકાદા અને દલીલોમાં હવે જન્ડર સ્ટીરિયોટાઈપ શબ્દોનો ઉપયોગ થઈ શકશે નહીં. સુપ્રીમે મહિલાઓ માટે ઉપયોગમાં લેવાતા આપતિજનક શબ્દોથી અંતર જાળવવાનું કહ્યું છે. આ ઉપરાંત તેમના વિકલ્પ તરીકે કયા શબ્દોનો ઉપયોગ થઈ શકે તે માટે હેન્ડબુક બહાર પાડી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે જન્ડર સ્ટીરિયોટાઈપ શબ્દોને દૂર કરવા માટે એક હેન્ડબુક લોન્ચ કરી છે. જે જજોને કોર્ટના આદેશોમાં અનુચિત જન્ડર શબ્દોના ઉપયોગથી બચવામાં મદદ કરશે. સીજેઆઈ ડી વાય ચંદ્રયૂઝે હેન્ડબુક લોન્ચ કરતા કહ્યું કે તેમાં આપતિજનક શબ્દોની યાદી છે અને તેની જગ્યાએ કયા શબ્દોનો

ઉપયોગ કરી શકાય, તે વિશે જણાવવામાં આવ્યું છે. આ શબ્દો આદેશ આપવામાં અને તેની કોપી તૈયાર કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે. સીજેઆઈએ કહ્યું કે આ હેન્ડબુક તૈયાર કરવાનો હેતુ કોર્ટ નિર્ણયની ટીકા કરવાનો કે શંકા કરવાનો નથી પરંતુ એ જણાવવાનો છે કે જાણે અજાણ્ય રૂઢિવાદી પરંપરા ચાલી આવી રહી છે. કોર્ટનો હેતુ એ દર્શાવવાનો છે કે રૂઢિવાદીતા શું છે અને તેનાથી શું નુકસાન છે. જેથી કરીને મહિલાઓ વિરુદ્ધ આપતિજનક શબ્દોના ઉપયોગથી બચી શકાય. અફેરની જગ્યાએ લગ્ન બહારના સંબંધ જેવા શબ્દોનો ઉપયોગ કરવો. હેન્ડબુકમાં ૪૦ અયોગ્ય શબ્દોની જગ્યાએ નવા શબ્દો જણાવવામાં આવ્યા છે.



ન્યૂઝ ફ્રિફ

રિક્ષામાં ડ્રગ્સનું વેચાણ કરતા એક શખ્સની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ, તા. ૧૭ |

અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી સતત પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે માંડલ ગામમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ગ્રામ્ય SOGએ રૂ. ૬ લાખની કિંમતનું ૫૯.૦૮૦ ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો રાખી વેચાણ કરતા મુસ્તવર સાલારની પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા જ નાના ચિલોડા પાસેથી ૩ લાખથી વધુની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ૩૧.૬ ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ૪ લોકોની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રૂ. ૬ લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.

બાપુનગરમાં

અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો

અમદાવાદ, તા. ૧૭ |

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો તલવારો સાથે રોક જમાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ એક કારને આગ લગાડી હતી. તો આ ગેંગ બનાવીને ડરાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં એક આરોપી સામે ૭, તો અન્ય એક આરોપી સામે ૨ ગુના દાખલ થયા છે. આ અગાઉ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેકામ બન્યાં હતા.

રાજકોટમાં આતંકવાદી ઝડપાયા બાદ સુરેન્દ્રનગરમાં SOG પોલીસ સતર્ક થઈ

રાજકોટ, તા. ૧૭ |

રાજકોટમાં આતંકવાદી ઝડપાયા બાદ સુરેન્દ્રનગરમાં SOG પોલીસ સતર્ક થઈ છે. બંગાળથી આવી સોની કામ કરનારા કારીગરોની નોંધણી કરવામાં આવી હતી. નોંધણી માટે SOG પોલીસ કચેરી બહાર કારીગરોની લાંબી કતાર લાગી. સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૮૧ પરિવારજનો કલકત્તાથી આવી વસવાટ કરી રહ્યા છે. જેથી તમામ પરિવારજનોના આધાર કાર્ડ, પાનકાર્ડ રહેણાંકના પુરાવાઓની નોંધણી કરાઈ હતી. બંગાળી લોકો સોની વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જામનગરમાં ધારાસભ્ય- મેયર વચ્ચે તૂટ મેમે

જામનગર, તા. ૧૭ |

સમગ્ર રાજ્યમાં 'મેરી મીટ્ટી, મેરા દેશ' કાર્યક્રમની જીલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરમાં 'મેરી મીટ્ટી, મેરા દેશ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને મેયર વચ્ચે મામલો બિચકતા ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ત્યારે જાહેર કાર્યક્રમમાં ત્રણેય મહિલાઓ વચ્ચે તું...તું...મૈ...મૈ... સર્જતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

જામનગરમાં કાર્યક્રમમાં થયેલ બોલાચાલીનો મામલો ગાંધીનગર કમલમ ખાતે પહોંચતા મોવડી મંડળ પોતાનાં સંપર્ક

સુત્રથી સમગ્ર મામલાની તપાસમાં લાગી ગયું હતું. જામનગરમાં રિવાબા અને પૂનમ માડમ તેમજ મેયર વચ્ચેની તીખી બોલાચાલીની ઘટનાની પ્રદેશ અધ્યક્ષે નોંધ લીધી. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસકોન્ફરન્સ યોજાઈ. જેમાં રિવાબા અને પૂનમ માડમની રડકડક વિશે તેમને પુછાતાં તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે તેઓ માહિતી મેળવી રહ્યા છે.

જે બાદ આ અંગે પ્રદેશ સંગઠન સાથે વિમર્શ કરવામાં આવશે. મહત્વનું છે કે ચપ્પલ ઉતારવા જેવી બાબતે સાંસદ પૂનમ માડમના નિવેદન બાદ રિવાબા જાહેરા સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન પર ગુસ્સે થયા હતા. જેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર

પ્રદેશના રાજકારણમાં આ અંગે ચર્ચા શરૂ થઈ હતી.

જામનગરમાં ધારાસભ્ય-મેયર વચ્ચે થયેલ બોલાચાલી બાદ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જામનગરનાં જનપ્રતિનિધિ જનતાનો ભરોસો તોડી રહ્યા છે. જામનગરની ઘટનાં વર્ચસ્વ સ્થાપિત કરવાની લડાઈ હોય તેવું લાહે છે. જામનગરની જનતાનાં પ્રશ્નોની લડાઈ નથી લડતા.

જામનગરમાં ધારાસભ્ય-મેયર વચ્ચે થયેલ બોલાચાલી મામલે મેયરને પૂછતા બીનાબેન કોઠારીએ આ બાબતે કહ્યું હતું કે, આ અમારો ભાજપનો પારિવારિક મામલો છે. હું આ અંગે કોઈ કોમેન્ટ નહીં કરૂં.



છેલ્લા બે મહિનાથી શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે

આજથી એક સપ્તાહ શિક્ષકો કાળા કપડા પહેરીને વિરોધ કરશે

રાજ્યની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, આચાર્ય, સંચાલકો અને વહીવટી કર્મચારીઓ વિરોધ નોંધાવશે

ગાંધીનગર, તા. ૧૭ |

શિક્ષણ સંકલન સમિતિનો આરોપ છે કે તકલિન શિક્ષણ મંત્રીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની કાયમી ભરતી કરવા, બિન શૈક્ષણિક કર્મચારીઓ પટાવાળા અને કલાર્કની ભરતી કરવા સહિતની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હતી પરંતુ જેને સમયે ખાતરી બાદ હવે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે છેલ્લા બે મહિનાથી શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં

જ્ઞાન સહાયક હેઠળ ૨૬,૫૦૦ શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે ૧૫,૦૦૦ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૧૧,૫૦૦ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત ૫૦૭૫ ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂક કરશે. કરાર આધારિત નિમણૂક મેળવેલ ઉમેદવારોને ૨૧૦૦૦ ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.

પ્રામ વિગતો પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક



શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન

થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઈ શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય કરવામાં આવેલ છે. રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ' માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક

ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર કરાર આધારિત 'જ્ઞાન સહાયક' મૂકવા માટે નિર્ણય કરવામાં આવેલ છે. આ માટે પ્રાથમિક શાળાઓમાં ૧૫૦૦૦ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ૧૧૫૦૦ જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂક મેળવેલ પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને ૨૧૦૦૦ માધ્યમિક વિભાગ માટે ૨૪૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે રૂપિયા ૨૬૦૦૦ ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.

આંબેડકર ઓપન યુનિવર્સિટીને મોટો ઝટકો BAOUને BBA, BCA, BBA-AT અને MSW જેવા કોર્ષ ચલાવવાની મંજૂરી ના મળી

કોર્ષ ચલાવવાની મંજૂરી ના મળતા ૧,૦૪૫ વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ, ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ફી પણ લેવાઈ ચૂકી હતી

અમદાવાદ, તા. ૧૭ |

આંબેડકર યુનિવર્સિટીને BBA, BCA, BBA - AT (એર ટ્રાફિક) અને MSW જેવા કોર્ષ ચલાવવાની મંજૂરી ના મળી. યુજીસીના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો દ્વારા મંજૂરી ના અપાઈ. વિવિધ માપદંડોને ધ્યાને લઈ યુજીસી ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો દ્વારા યુનિવર્સિટીઓને જુદા જુદા કોર્ષ ચલાવવાની આપવામાં આવી હતી. આંબેડકર યુનિવર્સિટીને BBA, BCA, BBA - AT (એર ટ્રાફિક) અને MSW જેવા કોર્ષ ચલાવવાની મંજૂરી ના મળતા ૧,૦૪૫ વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ. ચાલુ વર્ષે

૬૨ પાંચ વર્ષે મંજૂરી લેવાની રહે છે, જે મુજબ BAOU દ્વારા ૧૬ કોર્ષ માટે ૩૧ માર્ચે અરજ કરાઈ હતી. ૧૬ કોર્ષમાંથી શરૂઆતમાં ૨૧ જૂને ૩ કોર્ષની જ મંજૂરી મળતા બાકીના ૧૩ કોર્ષની મંજૂરી મેળવવા ૧૪ જુલાઈએ આંબેડકર યુનિવર્સિટી અપીલમાં ગઈ હતી. ત્યારબાદ વધુ ૯ કોર્ષની મંજૂરી ૩૧ જુલાઈએ મળી હતી, આખરે ૧૬ માર્ચે ૪ કોર્ષની મંજૂરી આખરે ના જ મળી. આંબેડકર યુનિવર્સિટીને BBA, BCA, BBA - AT (એર ટ્રાફિક) અને MSW જેવા કોર્ષ ચલાવવાની મંજૂરી ના મળતા ૧,૦૪૫ વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ. ચાલુ વર્ષે

વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ફી પણ લેવાઈ ચૂકી હતી, હવે આ સ્થિતિમાં તમામ ૧,૦૪૫ હજાર જેટલા વિદ્યાર્થીઓનું એકવર્ષ બગડે તેવી શક્યતા. મ્મ્મ્ ૧૯૦, BCA માં ૨૬૬, BBA - AT (એર ટ્રાફિક)માં ૧૮ અને સ્ક્રીટ માં ૫૭૧ વિદ્યાર્થીઓએ મ્મ્મ્ ખાતે પ્રવેશ લીધો હતો. આંબેડકર યુનિવર્સિટીને યુજીસીના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો તરફથી મંજૂરી ના મળતા વિવિધ રિજિનલ સેન્ટરને જાણ પણ કરાઈ સુરત, રાજકોટ, ભાવનગર, ગોધરા, ભુજ સહિતના સેન્ટરના રિરેક્ટરોને ઈમેઈલ કરી અપાયેલા પ્રવેશ રદ કરી દેવા જાણ કરાઈ.

સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતનાં લોકો માટે જી વિભાગનો મોટો શ્રાવણ મહિનામાં ST નિગમ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવશે

મોરબીથી રફાળેશ્વર મહાદેવ મંદિર માટે વધારાની બસ દોડશે જસદણથી ઘેલા સોમનાથ માટે પણ વધારાની બસ મૂકાઈ છે

ગાંધીનગર, તા. ૧૭ |

શ્રાવણ માસ તહેવારોનો મહિનો છે. જેમાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ સહિતના તહેવારો ઉપરાંત ગણતરિયા આવા છે, ત્યારે તહેવારોની આ સિઝનમાં ST નિગમે એક્સ્ટ્રા સંચાલન કરીને સારી આવક મેળવે તેનું આયોજન કરી લીધું છે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ ભક્તો માટે મુશીના સમાચાર મળી રહ્યા છે. ST વિભાગ શ્રાવણ મહિનામાં એક્સ્ટ્રા બસ દોડાવશે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ ST નિગમ એક્સ્ટ્રા બસ દોડાવશે. આ વર્ષે જૂનાગઢ- સોમનાથ

મિની બસ સેવા રાખવામાં આવી છે. મોરબીથી રફાળેશ્વર મહાદેવ મંદિર માટે વધારાની બસ દોડશે. જસદણથી ઘેલા સોમનાથ માટે પણ વધારાની બસ મૂકાઈ છે. ધાર્મિક મેળાવા સાથે ત્યાં પણ ખાસ બસની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. યુપમાં ધાર્મિક સ્થળે જવું હોય તો તેના માટે પણ વ્યવસ્થા કરવાનું સુચન કરાયું છે. દરેક ડિવિઝનમાં ૧૦ રહ્યા છે. ST વિભાગ શ્રાવણ મહિનામાં એક્સ્ટ્રા બસ દોડાવશે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ ST નિગમ એક્સ્ટ્રા બસ દોડાવશે. આ વર્ષે જૂનાગઢ- સોમનાથ

જણાય ત્યાં વધુ બસ મુકવાનું સુચન કરાયું છે. મહત્વનું છે કે, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઈને ૬૨ વર્ષે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ લોકોનો ધસારો વધુ હોય છે. તહેવારોમાં જરૂરિયાત મુજબ વધારાની બસ શરૂ કરવાની પણ ડેપો મેનેજરને સૂચના અપાઈ છે. તહેવારોના અનુસંધાને રાજ્યમાં અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, વડોદરા, ભાવનગર, વલસાડ, રાજકોટ, પાલનપુર, મહેસાણા, નડિયાદ અને ભરૂચ સહિતના વિસ્તારમાં પણ વધારાની બસ શરૂ કરવામાં આવશે.

સપ્તાહમાં રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ ૧૦થી ૧૫ રૂપિયા જેટલા ઊંચકાયા

અમદાવાદ, તા. ૧૭ |

પહેલા ૨૦૦થી ૨૫૦ રૂપિયે કિલો મળતા હાલ ટામેટાએ લોકોને રડાવ્યા. જે ટામેટાના ભાવ હાલ ૮૦થી ૧૦૦ પહોંચતા લોકોને રાહત મળી છે, પરંતુ હવે તીખી ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કરી દીધું છે. કેમ કે ટામેટા અને શાકભાજીના ભાવ ઘટ્યા પણ ડુંગળીના ભાવમાં હવે વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનાથી શાકભાજીના ભાવ અને તેમાં પણ ટામેટાના ભાવ આસમાને હતા. ટામેટા ૧૫ દિવસ પહેલા બજારમાં કિલોના ૨૦૦થી ૨૫૦ રૂપિયા હતા. ત્યારે હવે ટામેટાની આવક શરૂ થતાં તેના ભાવમાં ઘટાડો થયો છે. હાલ ટામેટા ૧૦૦ રૂપિયાની

આસપાસ બજારમાં મળી રહ્યા છે. પરંતુ હવે ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કર્યું છે. આમ તો ડુંગળી તીખી હોય એટલે લોકોને રડાવે, પરંતુ તેના ભાવે હવે લોકોને રડાવવાનું શરૂ કર્યું છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે, કારણ કે એક જ સમાહમાં રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ ૧૦થી ૧૫ રૂપિયા જેટલા ઊંચકાયા છે. જેના કારણે હવે લોકોના બજેટ પર અસર સર્જાઈ છે. ડુંગળી એક સમાહ પહેલા એપીએમસી બજારમાં પ્રતિ કિલો ૨૦ રૂપિયા આસપાસ મળતી હતી. જ્યારે જમાલપુર રિટેઇલ બજારમાં ૩૦ રૂપિયા આસપાસ મળતી હતી. પરંતુ એક જ સમાહમાં આ ભાવમાં વધારો નોંધાયો

છે. જેમાં એપીએમસીમાં હાલ આ ડુંગળી ૨૫થી ૩૦ રૂપિયા ભાવે મળી રહી છે. જ્યારે રિટેઇલ બજારમાં ૪૦ રૂપિયે કિલો ડુંગળી મળી રહી છે. તો શહેરમાં વિસ્તાર પ્રમાણે ભાવ વધુ જોવા મળી રહ્યો છે. કે જ્યાં કેટલાક વિસ્તારમાં ૫૦થી ૬૦ રૂપિયા કિલો ડુંગળી મળી રહી છે. ભાવ વધવાના કારણે જે વાનગીમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. તેમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. વેપારીઓની વાત માનીએ તો બજારમાં ડુંગળી નાશિક, પુને, કાઠીયાવાડ અને સૌરાષ્ટ્રમાંથી આવતી હોય છે. જેમાં હાલ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડથી ડુંગળી આવવાનું બંધ છે અને માત્ર નાશિક અને પુણેથી ડુંગળી આવી રહી છે.

તંત્રના પાપે શહેરીજનોને હેરાન થવાનો વારો આવ્યો નારોલમાં ખાડામાં ફસાતા સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ

અમદાવાદ, તા. ૧૭ |

અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર મહાનગરપાલિકાએ ખાડા ખોદી નાંખ્યા છે. ત્યારે તેને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓમાં અમદાવાદની જનતા જ પડી રહી છે. તંત્રના પાપે શહેરીજનોને હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યારે નારોલની એક ઘટના બાદ શહેરીજનોમાં આકોશ ફેલાયો છે. મળતી માહિતી પ્રમાણે, નારોલ વિસ્તારમાં એક સ્કૂલ રિક્ષા ફસાઈ હતી અને સ્કૂલ રીક્ષા પલટી ખાઈ

જતા સ્કૂલ રિક્ષામાં સવાર બાળકોને ઈજાઓ પહોંચી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ બાળકોને ઈજા પહોંચવાની આટલી મોટી ઘટના બાદ તંત્રની બેદરકારી સામે આવી છે અને સ્થાનિકો દ્વારા તંત્ર પ્રત્યે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. નારોલ વિસ્તારમાં શક્તિ વિદ્યામંદિર સ્કૂલના બાળકો શાળાએ જવા સ્કૂલ રિક્ષામાં જઈ રહ્યા હતા. ત્યારે કાદવમાં રીક્ષા ફસાઈ જતા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષા પલટી મારી જતા સવાર બાળકો પણ કાદવમાં પડ્યા હતા.

પત્રકાર નિમવાના છે... આણંદ, ખેડા, વડોદરા જિલ્લામાં માનદ્ પત્રકારો નિમવાના છે.. મનિષ પ્રજાપતિ મો. 70966 59890

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત દૈનિક સમાચાર પત્ર ઉપાડો ફોન 9800708900 આ નંબર પર માત્ર વોટ્સએપ મેસેજ જ કરવો આપની આસપાસ બનતી ઘટનાઓના ફોટાઓ વિડીયો મોકલી આપો દરેક જાતના પ્રસંગ, ઉમંગ, શાળાઓ, કોલેજોથી લઈને સોસાયટીઓ સુધી અવસરથી લઈને તહેવારો સુધી બધા જ સમાચારોને આવરી લેતુ અખબાર "ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત" દૈનિક હંમેશા તૈયાર રહે છે, આપની આસપાસ બનતી રસપ્રદ ઘટનાઓની માહિતી વોટ્સએપ નંબર ઉપર અથવા ઈ-મેઈલ પર અમને લખીને મોકલો... cngujarat@gmail.com